

એવી જીવનું હો?

જીવન



- ખોલ સ્ટી. ડૉ.



દુર્ગા



શ્રી અંબ. પી. પટેલ શુક્લાકેશ્વર પ્રકાશન

## પ્રકાશકનું નિવેદન

તંહુરસ્ત, નીરોગી અને દીર્ઘયુ જીવન જીવનાનો આદર્શ કર્યો  
માનવી ન સેવે? પરંતુ આજના ધાંધક-ધમાલના વાતાવરણમાં  
ચિંતાઓ અને માનસિક દ્રાષ્ટ્વાની વચ્ચે કૃતિમ અને અનિયમિત  
જીવન જીવતો માનવી પોતાના આરોગ્યની સૌથી વધુ ઉપેક્ષા કરતો  
હોય છે! ‘તન દુરસ્ત તો મન પણ દુરસ્ત’ અને ‘આરોગ્ય જળયું  
એટલું આયુષ સાચયું’ એ સનાતન સત્યો. વર્તમાન સંહર્ષમાં  
ખરાખર સમજુને આપણે જીવનમાં ઉતારીએ તો જીવન અનેરા  
આનંદનો એક આહ્લાદક અનુભવ બની જાય!

કુદુરતના નિયમોની સાથે તાલ મિલાવીને જીવન જીવનાનું  
આપણે હેતુપૂર્ણ આયોજન કરીએ તો પ્રસ્તુત પુરિતકામાં સુપ્રસિદ્ધ  
અમેરિકન આરોગ્યશાસ્ત્રી અને લેખક શ્રી પોલ સા. એને ‘સવાસો વરસ  
જીવનું છે?’ નો રજૂ કરેલ પ્રસ્તાવ નજીર વારતવિકાનું સરદિપ સહંજતાથી  
ધારણ કરી શકે! શ્રી એનેની અનુભવી કલમે લખાયેલી આ પુરિતકામાં  
આરોગ્યની જળવણી માટેનાં સરળ અને અનુકરણીય સૂચનો તથા  
સચોટ અને ઉપયોગી માર્ગદર્શન ખૂબ રસપ્રદ શૈક્ષિકમાં રજૂ કરાયાં છે.

શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન પ્રકાશન તરફથી ૧૯૮૩  
દરમિયાન શરૂ કરાયેલ ‘જીવન ધડતર પ્રકાશન શ્રેષ્ઠી’ની પ્રથમ ત્રણ  
કૃતિઓ ‘જીવન જીવનાની કલા’, ‘ઉચ્ચ જીવન’ તથા ‘જીવન સંધ્યાનું  
સ્વાગત’ ને મળેલ ઉભાભર્યાં અવકારથી પ્રેરાઈ ને...આ જ શ્રેષ્ઠીમાં  
ચોથું પુસ્તક પ્રસ્તુત કરતાં આનંદ અનુભવીએ છીએ. મૂળ અંગ્રેજ  
પુસ્તકનો ગુજરાતીમાં સુંદર અનુવાદ કરનાર સુ. ભાઈ શ્રી નટરલાલ  
જનીનો, તેમજ આ પુસ્તકના પ્રકાશન આયોજન પાછળ લીધેલ  
પરિશ્રમ બહુલ અમારા સ્નેહીમિત્ર ‘નવેચતન’ના તંત્રી શ્રી સુકુન્દ  
પી. શાહનો આલાર માનીએ છીએ. આ પુસ્તક સંખ્યાં વાયક  
મિત્રોનાં રચનાત્મક સૂચનો આવકારીશું.

શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન પ્રકાશન  
'મીના', ૧, સરદાર પટેલ ડોલોની,  
નવજીવન, અમદાવાદ-૩૮૦ ૦૧૪

મંગળભાઈ પી. પટેલ  
મૂકેશ એમ. પટેલ  
૧૩મી એપ્રિલ ૧૯૮૪



શ્રી એમ. પી. પટેલ ઇન્ડિયન  
 'જીવનઘડતર પ્રકાશન ક્રીષી'ની ચોઢી લેણ  
 તંડુરસ્ત, નીરોગી અને હીર્દાયુ જીવન જીવવા માટે અનુકરણીય  
 અને ઉપયોગી ભાર્ગવિશાળ સબર ખુસ્તાક

# સવાસો વરસ જીવવું છે ?

પોલ સી. એગ

અનુવાદક : રવ. નરપતિલાલ જાની

સનેહાશી.....

તંડુરસ્ત, નીરોગી અને હીર્દાયુ જીવન.....


સહા આપનું સાથી બની રહેણી

એવી અંતરની શુભ કામનાએ સહ.....

સપ્રેમ

મંગળભાઈ પી. પટેલ

મૂડેશ એમ. પટેલ



શ્રી એમ. પી. પટેલ ઇન્ડિયન પ્રકાશન

'મીના', ફેસ્ટલાઇન, નવજીવન,  
 અમદાવાદ-૩૮૦૦૧૪, ફોન : ૪૪૦૮૧૦

SAVASO VARAS JEEVAVUN CHHE ?  
WRITTEN BY PAUL C. BRAIG  
FOURTH PUBLICATION OF  
SHRI M. P. PATEL FOUNDATION  
JEEVAN GHADTAR PRAKASHAN SHRENI  
AUGUST 1984

\* સવાસો વરસ જીવવું છે ?

લેખક : પોલ સી. બ્રેગ

અતુવાદી : રવ. નટવરલાલ જાની

(કુસુમ પ્રકાશન અમદાવાહની સંમિથી પ્રકાશિત)

\* મુનર્મદ્રષ્ટુ : ઓગસ્ટ ૧૯૮૪

\* મૂલ્ય : સહભાવ-સુવાચન-સર્વાચારન

\* પ્રકાશક :

શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશન વતી શ્રીકૃમુક્ષા એમ. પટેલ  
'મીના' ૬, સરદાર પટેલ કોલોની, નવજીવન, અમદાવાદ-૧૪  
ફોન : ૪૪૦૮૧૦

\* પ્રકાશન આયોજન : કુસુમ પબ્લિકેશન્સ, અમદાવાદ-૭

ફોન : ૪૧૦૮૫૮

\* આવરણ : ભયૂર જાની

\* મુદ્રક :

હરિ એમ્. પ્રિન્ટરી  
દૂર્ઘેખર રોડ, અમદાવાદ-૨

## અર્પણ



પૂ. ભણીયાને.....

જેમનાં ત્યાગ, સેવા અને વાતસલ્યની નિશામાં  
જીવન સાર્થક બન્યું !  
આજે કષ્ટ વર્ષની ઉંમરે પણ.....  
જેએઓ હિયાશીલ અને પ્રકૃતિલિત છે.....  
તેમને સવાસો વર્ષનું આયુષ્ય પ્રાર્થીએ !!

—પરિવારનાં સ્વજનો

## અનુકૂળભિંડા

૧ તમે પણ સવાસો વરસ જીવતા રહી શકો છો !!	૫
૨ તંડુરસ્તીની શૈખા	૧૨
૩ વૃક્ષાવસ્થા શા માટે ?	૧૭
૪ ઉપવાસથી જ આરંભ કરો	૨૪
૫ ફ્લેયરના ડેટલાય અનુયાયીએ દીઘાદુષા બન્યા	૩૦
૬ પોષણનું આગવું રખાના	૩૬
૭ હું ભારતીય સંતો પાસેથી શું શરીરખે ?	૪૪
૮ ઝોરાકની પસંદગી	૫૦
૯ જીવનનું વાસ્તવિક તત્ત્વ : શુદ્ધ વાયુ	૫૭





[ ૧ ]

## તમે પણ સવાસો વરસ જીવતા રહી શકો છો !

ઇશ્વરે કહ્યું : 'મારો આત્મા માણુસ માટે સંઘર્ષ-શીલ નહિ રહે કારણ કે તે માંસપિંડ છે. આમ હોવા છતાંથ તે સવાસો વરસ સુધી જીવતો રહી શકે છે!' ઇશ્વરે આપણુને આ સત્યનું વરદાન આપ્યું છે ! આ વરદાન પાછું એંચી લેવાનો કોઈને હુક નથી.

માણુસનું સરેરાશ આયુષ્ય અડસઠ વરસ જેટલું વધી ગયું છે તે જાણીને આપણુને આનંદ થાય છે. માણુસની સતત મહેનતનું આ પરિણામ છે. આ પરિણામ મેળવતાં લગભગ સો જેટલાં વરસ પસાર થઈ ગયાં. પરંતુ ઇશ્વરે આપણુને સવાસો વરસ જેટલું જીવવાનું વરદાન આપ્યું હોય તો આપણે વધારે શ્રદ્ધા અને સજગતા સાથે તંહું રસ્તીના નિયમોને અનુસરીને તેના કીમતી આદેશોનું શા માટે પાલન ન કરવું ? જે લોકો પોતાની જતને મહદ્દ કરે છે, તેમને જ ઇશ્વર મહદ્દ કરે છે. આપણે આપણી જતને મહદ્દ ન કરીને લાંબા આયુષ્યનો આનંદ પ્રાપ્ત કરવાથી શા માટે વંચિત રહેવું જોઈએ ? આ આનંદ જતો કરવા માટે કોઈ જ કારણ નથી.

## સવાસો વરસના આયુષ્યમાં શક્તિસલર અને સ્કૂર્ટિભય સ્વાસ્થ્ય

હિમાલયના ભિંચા ટેકરાળ પ્રદેશમાં એક ખાસ જલિના લોકો રહે છે. આ લોકો સારામાં સારી તંહુરસ્તી ભોગવે છે. તેમનું સરાસરી આયુષ્ય પણ સવાસો વરસ જેટલું હોય છે. આપણું એથીરે આયુષ્યનું જે વરદાન આપ્યું છે તે પણ આટલું જ છે.

હુંના જલિના લોકો નિર્ણય અને અશક્તતા રાષ્ટ્રના વતનીઓ નથી.... આ લોકો શક્તિશાળી, સ્કૂર્ટિલા અને સંપૂર્ણ પુરુષાતનવાળા છે. આ લોકો હુંના પ્રદેશના વતનીઓ છે. આ લોકો પચાસ, સાડ કે સિતોરમા વરસે મોતના મોંચોં હોમાતા નથી. સવાસો વરસે પણ આ લોકો સ્કૂર્ટિભય જીવન પસાર કરે છે. અહીંના પુરુષોમાં એંસી કે નેવું વરસે સંતાનોત્પત્તિ કરવાની શક્તિ હોય છે. તેમના જીવનનો અભ્યાસ કરવાથી જણાઈ આવે છે કે ગરીબાઈમાં જીવવા છતાંય આ લોકો લાંખા આયુષ્યના હક્કદાર બને છે. આ હકીકતને વિજ્ઞાન પણ ટેકો આપે છે.

## સવાસો વરસ જીવવાની કલા

સવાસો વરસ સુધી નિરામય જીવન પસાર થાય એમાં જ શક્તિમય સ્વાસ્થ્યની પૂર્ણતા છે. વૃદ્ધાવસ્થા અને અશક્તિનાં લક્ષણો સ્વભનમાં પણ ન વરતાવાં જોઈએ. એથીરદત્ત આયુષ્યના લક્ષ્યાંક સુધી પહોંચવું એ કોઈ કાદ્યનિક આફર્સ નથી. આ લક્ષ્યાંક સુધી પહોંચવાને

આપણા સૌનો હુક છે. જીવનમાં લાંબા સમયના નિરીક્ષણ અને મનન પછી હું આ નિર્ણય પર આવ્યો છું. જીવનને વ્યવસ્થિત રીતે પસાર કરવા માટે મેં કેટલાક નિયમો તૈયાર કર્યા છે. આ નિયમો પાળવાથી કોઈ પણ માણુસ જીવનના કમોસમી વિનાશથી બચી શકે છે.

આ પુસ્તકમાં હું કુદરતના અદ્દર સિદ્ધાંતો પર પ્રકાશ પાડવા છિછું છું. આ નિયમો અનુભવના આધારે ઘડાયેલા છે. કુદરતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાથી સવાસો વરસ જેટલું આચુષ્ય સારી રીતે પસાર કરી શકાય છે. મારી એવી માન્યતા છે કે કુદરતના નિયમોનું પાલન કરવાથી માણુસ શારીરિક હુઃખોમાંથી તો અવશ્ય છુટકારો મેળવી શકે છે. ઘડપણુમાં માણુસને અશક્તિનો અનુભવ પણ થતો નથી.

સવાસો વરસ જેટલું લાંબું આચુષ્ય લોગવવું એ કોઈ કાહ્યપનિક વાત નથી. આપણે છાશવારે વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ કે હુનિયાના ‘ફલાણુા’ શહેર કે ગામના રહેવાસીએ પોતાનો ૧૨૫મો જનમદિન ઉજ્જવ્યો. આપણું માટે આ પ્રકારનું લાંબું જીવન અપવાદરૂપ જ ગણી શકાય. જે આપણે હુઃખ અને ચિંતારહિત, ખોટી રહેણી-કરણીના ત્યાગવાળું સંયમપૂર્ણ જીવન જીવીએ તો એમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નહિ હોય કે આ હુનિયાનો હરકોઈ માણુસ સવાસો વરસ જેટલું સુખમય જીવન જીવી શકે છે.

આ સુંદર અને સુખમય લુલન પ્રાપ્ત કરવાનાં સાથેનો અત્યંત સરળ અને મનોરંજક છે. ઈશ્વરના નિયમોનું પાલન કરો અને આ નિયમો પર ચાલવાનો બ્રયત્ન કરો. પછી લક્ષ્યાંક તમારાથી ફૂર નહિ જ હોય.

આ પુસ્તકનો આ જ ઉદ્દેશ છે. મને આશા જ નહિ પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા છે કે આ પુસ્તક વાંચ્યા ગઢી તેના નિયમોનું લુલનમાં પાલન કરવાથી વાચોનો હૃદભાંથી છુટકારો તો થશે જ; સાથેસાથે તેમની આત્મશ્રદ્ધા અણુ વધશો. તેમને આનંદનો અનુભવ પણ થશે.

અહીં સુધીનું પુસ્તક વાંચ્યા પછી તેના સિદ્ધાંતો અને વ્યાવહારિક નિયમોનું પાલન કરવાથી માણુસને એક પ્રકારના ઈશ્વરીય આશીર્વાદનો અનુભવ થશે અને તેની શારીરિક તકલીફોનું આપમેળે નિવારણ થઈ જશે.

**વિચારશીલ વ્યક્તિ જ્યારે પોતાના લુલન પર ચિંતન કરવાની શરૂઆત કરે છે, ત્યારે તેના સાચા લુલનનું પહેલું પગથિયું મંડાય છે.**

શહેરોમાં સૌંદર્ય પ્રસાધનોની સાથે સાથે કલપ અને વાળ કાળા કરનારા ભીજા રંગોનું વેચાણુ પણ વધી ગયું છે. સૌંદર્ય પ્રસાધનોના નિર્માતાઓ આકર્ષક રીતે તેમના રંગ અને ડાઈઓ(કલપ)નો પ્રચાર કરે છે. આ રંગોના પ્રચાર પાછળ લાખો ડાયિયા પાણીની જેમ વહેવડાવવામાં આવે છે. ધોળા વાળને વૃદ્ધાવસ્થાતી જિશાની માનતાં

લાખો સ્વીપુરુષો વરસેદહાડે કલખથી ઘોળા વાળને કાળા  
રંગીને પોતાની સાચી ઉંમરથી ઓછી ઉંમરના દેખાવાનો  
પ્રયત્ન કરે છે.

પોતાની સાચી ઉંમરને કૃત્રિમ સૌંદર્ય પ્રસાધનોનો  
ઉપયોગ કરીને ઓછી બતાવવાનો રિવાજ થઈ પડ્યો છે.  
કેટલાંય ચુવક-ચુવતીએ પોતાના ચેતન-અચેતન મનની  
પ્રેરણુથી પ્રેરાઈને કાંતિવર્ધક સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ  
કરીને પોતાની સાચી ઉંમરને ઓછી દેખાડવાનો ફંલ કરે  
છે. ઉંમર વારંવાર ચેતવણી ઉચ્ચારે છે : જોખમ છે....ધીમે  
ચાલો. ધીમે ધીમે તમારું આયુષ્ય ઓછું થાય છે. જે  
ઇશ્વરહંત કુદરતી નિયમોનું પાલન કરવામાં આવે તો જ  
આ ચેતવણી આપણું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે પ્રેરણાર્થ  
ખંતી શકે છે. મનમાં વારંવાર અવાજ ઊઠે છે : તમે  
ચુવાન છો. આ હુનિયા તમારી છે. તમારા લક્ષ્યાંક તરફ  
અડપથી હોટ મૂકો. રસ્તો મોકણો છે.

આપણે ગમે તેટલો પ્રયત્ન કરીને આપણી સાચી  
ઉંમરને ઓછી બતાવવાનો પ્રયત્ન કરીએ, પરંતુ આ એક  
સનાતન સત્ય છે કે જેમ જેમ આપણું આયુષ્ય ઓછું  
થતું જાય છે, તેમ તેમ આપણે આપણા આયુષ્યની પ્રત્યેક  
ક્ષણનો સહુપયોગ કરીએ તેમાં જ આપણા જીવનની  
સાર્થકતા ચિંદ્ર થાય છે અને આપણે આપણા લાંબા  
જીવનની મહત્વાકંક્ષા પૂરી કરી શકીએ છીએ.

આ હુકીકતનો સ્વીકાર કરવામાં આપણે કચારેય ખંચકાટ ન અનુભવવો જોઈએ કે આપણે ઉછીના લીધેવા સમયમાં જીવીએ છીએ. એક મોટા ઈજનેરે સ્પષ્ટપણે કખૂલ્યું છે : ‘તમારું જીવન સુખપૂર્વક પસાર થાય કે હુઃખપૂર્વક તેનો આધાર તમારા પર છે. પસાર થયેતા દ્વિસોને તમે પાછા બોલાવી શકતા નથી. એ પણ હીવા જેઠલું જ સ્પષ્ટ છે કે તમે ઈચ્છો કે ન ઈચ્છો તોય ઉંમર તમારી છે અને તમારે તેની સાથે રહેવાનું છે....’ માણુસ જમીન, દાણીના અને મકાનની કીમત પર ધ્યાન આપે છે; પરંતુ તે સમયની કીમતનો સ્વીકાર કરતો નથી. સમયના અલાવે માણુસ જીવી શકતો નથી. જે આપણે આપણા આધ્યાત્મની એક પળનો પણ નાશ કરીએ, તો આપણું ઉંમરની બેંકની અનામતમાંથી તેનો ઉપાડ કરીએ છીએ.

જે આપણે એક-એક સેકંડ, એક-એક મિનિટ, એક-એક કલાક અને એક-એક દ્વિસોનો સહુપયોગ કરીએ, તો તેનો અર્થ એવો થાય કે આપણે સમયરૂપી જમા-મૂડીમાં વધારો કરીએ છીએ. લાણો માણુસો સમયની કીમત સમજ્યા વિના આ હુનિયા પર જારરૂપ અનીને જિંદગીના દ્વિસો પસાર કરે છે. માણુસ વિચારશીલ પ્રાણી છે. તે સહૂ-અસહૂનો વિચાર કરી શકે છે. તેણે પ્રત્યેક પળની કીમત સમજીને તેનો સહુપયોગ કરવો જોઈએ અને પોતાની જમા-મૂડીમાં વધારો પણ કરવો જોઈએ. માણુસની આ નાની-શી ઉંમર વિશે વિચાર કરતાં નિરાશા


જ સાંપડે છે. એવો અનુભવ થાય છે કે માણુસ પોતાના પૂર્ણ આયુષ્યને લોગવ્યા વિના જ અધવચ્ચે આપદાત ન કરી રહ્યો હોય !

હરકોઈ માણુસની એવી ઈચ્છા હોય છે કે તે સો વરસથી વધારે જીવે. જિંદગીના પ્રત્યેક વરસને તે હુઃખ-રહિત અને ચિંતારહિત બનાવવા ઈચ્છે છે. તે જિંદગી સુખમય અને આનંદમય બનાવવા ઈચ્છે છે. હરકોઈ માણુસની જિંદગી તેની પોતાની મૂહીમાં છે. તે કોઈ પણ સમયે પોતાની જિંદગી શરૂ કરી શકે છે. આ જીવન-ધનતીર્થાચણી તરફ આપણે બહુ જ એછું ધ્યાન આપીએ છીએ. આપણે 'સો શરહ(કંતુ)ની જિંદગી'થી આગળ વધીને સવાસો વરસ કે તેનાથી પણ વધારે આગળ વધવાનું છે. આપણી પાસે સારી તંહુરસ્તી અને સ્કૂર્તિ હોય તો જ આપણે આટલા લાંબા જીવનનો હડ મેળવી શકીએ છીએ.



આહાર, વિહાર અને વિચારની શુદ્ધિ એ સ્વાસ્થ્યની જનેતા છે.





[ २ ]

## તંહુરસ્તીની શોધ

માણસ આજે તંહુરસ્તીની શોધમાં ભટકી રહ્યો છે. તે પોતાની જિંદગીના પ્રત્યેક વરસને હુઃખરહિત અને ચિંતારહિત પસાર કરવાની ઈચ્છા રાખે છે. તે આનંદથી જીવવા ઈચ્છે છે. પરંતુ આ એક સનાતન સત્ય છે કે જેની પાસે યોગ્ય પ્રમાણમાં તંહુરસ્તી જેવી વસ્તુ છે તેને તંહુરસ્તીનો અનુભવ થતો નથી; પરંતુ જેમ જેમ ઉમર વધતી જાય છે, તેમ તેમ તંહુરસ્તી વિશેની સંજગતા પણ વધતી જાય છે. તંહુરસ્તી વિશેની સંજગતાનો અભાવ ક્ષીણ જીવનશક્તિ અને માંદગીનો ઘોટક છે.

મને યાદ છે કે હું નાનો હતો ત્યારે માંદગીના બિધાને હતો. હું ક્ષયથી પીડાતો હતો. જિંદગીથી છુટકારો મેળવવા માટે મને છોડી મૂકવામાં આવ્યો હતો. પરંતુ હું મરવા ઈચ્છતો નહોતો. મેં તંહુરસ્તી વિશેની સંજગતા કેળવી અને સાચી તંહુરસ્તી પ્રાપ્ત કરવાના નિયમોનો અભ્યાસ શરૂ કર્યો. સૌ કોઈની ફરજ છે કે તેણે તંહુરસ્તી વિશે સંજગ રહેવું અને કુદરતે આપેલું પૂરેપૂરું આયુષ્ય લોગવવું. તંહુરસ્તી ગૌરવ લેવા જેવી વસ્તુ છે. તેના રક્ષણું

માટે સૌ ડેઈએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સજગતા લાંબું જીવન પ્રાપ્ત કરવાની લાલસા કે સ્કૂર્ટિના સંકેતરદ્વારા છે. સો વરસથી વધારે આચુષ્ય પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક રાખવું જોઈએ. આ લક્ષ્યાંક જ તમને આનંદની લાગણીમાં તરણોળ કરી મૂકશે.

### તંડુરસ્તી અને હીર્ઘાચુષ્ય પ્રત્યે સજગતા

મારો ઉદેશ તંડુરસ્તી અને હીર્ઘાચુષ્ય માટે પ્રેરણાસિંચન કરવાનો, સંપૂર્ણ તંડુરસ્તી માટે ઈચ્છાશક્તિ જાયત કરવાનો. અને સો વરસથી પણ લાંબું આચુષ્ય લોગવવાની ચેતનાને ઠંડોળવાનો છે. ઉંમર વધતી જ્ઞાન તેમ તેમ તમને યુવાનોની જેમ જિંદગી પસાર કરવાનો. સંપૂર્ણ આનંદ મળશે. કુદરતે તમારા આનંદ માટે પરિપદ્વ ઉંમરની જે ચોજના ધડી છે તેનો તમને લાલ મળશે.

તમારા મગજમાં તમારે જે શીખવાનું છે તે વસ્તુ સ્યાટ હોવી જોઈએ. તમારા અભ્યાસનો વિષય હોવો જોઈએ....તંડુરસ્તી. સંપૂર્ણ તંડુરસ્તી પ્રાપ્ત થાય તે પહેલાં તમારા મનમાં તમારી તંડુરસ્તી પ્રત્યે અસંતોષ હોવો જોઈએ. તમારે હંમેશાં તંડુરસ્ત ચેતનવંત પ્રાણી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે સારી રીતે શાસ કૈવામાં સમય પસાર કરો છો, કસરત કરવામાં સમય પસાર કરો છો અને પોષક ઐસાડના અભ્યાસ પાછળ સમય પસાર કરો છો—આ બધું તમારા ઉદેશને બર લાવવામાં મદદર્દી નીવડે છે. તમે સમયરૂપી જે ધનનો

વ्यय કરે. છે. તે તમને ચક્કવૃદ્ધિ વ્યાજ સાથે પરત મળીએ  
રહેશે. તંહુરસ્તીની બેંકમાં જે સમય અને પૈસો જમા  
કરવામાં આવે છે, તે જ બાયતનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. આમાં  
મિથ્યાલિમાન નથી. આ ક્ષેત્રમાં કાર્ય કરવાથી તમારી  
ચપળતા વધી જાય છે. તમારી સામાન્યિક ઉપયોગિતામાં  
પણ વધારે થાય છે.

### આચુષ્યની અભિવૃદ્ધિ

માણુસના પોતાના વિચારે જ તેને વૃદ્ધાવસ્થા તરફ  
હોરી જાય છે. જે માણુસ હુંમેશાં માંદો રહે છે કે જેની  
ઉંમર ૫૦-૬૦ વરસની થઈ ગઈ છે, તે હુંમેશાં ખીંદ  
લોકોને વૃદ્ધાવસ્થાનાં ખરાખ પરિણામોની આગાહી કરતો  
ફરે છે. તે પોતાની જતને દોષિત માનતો નથી. તે  
પોતાના દોષનું જ કુળ લોગવી રહ્યો હોય છે. તે ઉંમરનો  
જ દોષ કાઢે છે. આ ઉંમરે જે તેમને ઓછું દેખાય,  
યાદશક્તિ અંખી પડી જાય કે સ્ક્રૂટિંગમાં ઓટ આવે ત્યારે  
આ લોકો આ રીતે જ ઇરિયાદ કરતા સંભળાય છે—  
‘મારી સાડ વરસની ઉંમર થઈ છે. હું ધરડો થઈ ગયેટ  
છું. તમે મારી ઉંમરે પહોંચશો, ત્યારે તમારી આંખેએ  
પણ નથળી પડશો. હું ધરડો થતો જાડું છું. તમે ધરડા  
થશો. ત્યારે તમને પણ કંઈ યાદ નહિ રહે....’ આ કથનાં  
ઉંમરની બાધતમાં તદ્દન ખોટું છે. શરીરના કોષો પર  
ઉંમરની કોઈ જ અસર પડતી નથી. આ લયંકર નકારાતમક  
વિચારને તમારા મનમાંથી દેશવટો આપી દો. આ વિચારની

અસર તમારા મન પર રહેવા હેશો, તો તમારું અસ્તિત્વ જ જોગમાશે.

માણુસ પોતાના વિચારોનું મૂર્તિમંત સ્વરૂપ છે. તમે જે એમ માનતા હો કે ઘડિયાળનો 'ટક્ક....ટક્ક' અવાજ તમને બહેરા, આંધળા, બીમાર, નિર્ણણ કે ઘરડા બનાવે છે, તો તમે તમારા પગ પર જ કુહાડી મારો છો. આ વૈજ્ઞાનિક સત્ય નથી. આ જીવનનો નિયમ નથી. સમય માણુસના કોષો પર અસર પાડી શકતો નથી. માણુસની ખરાખ ટેવો અને ખરાખ વિચારોની જ તેના પર અસર પડે છે.

### હીર્ઘાયુષ્ય માટે પ્રયત્નશીલ રહેણો

માણુસને હીર્ઘાયુષ્યી બનાવવા માટે કુદરતે જુદા જુદા સંયોગોમાં શરીર પર નિયંત્રણ રાખવા માટે જે નિયમોનું ઘડતર કર્યું છે, તે પહેલાં પણ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ હશે. તમે જેવી કલ્પના કરો છો, તેવી જ શરીર પર સમયની અસર થાય છે. સમય વિશેના ખ્રી-પુરુષના વિચારો મરણોનુભી હોય છે. તે પોતાની જાતને મૃત્યુની સંહારક શક્તિથી સંરક્ષિત કે સુરક્ષિત માને છે. સમય (ઉંમર) માણુસને વૃદ્ધ બનાવે છે એવી માન્યતા તેમના મનમાંથી હુર ખસતી નથી. આ કારણુંને લીધે તેમના શરીરના કોષોમાં એકદમ ફેરફારો થવા માંડે છે. પરિણામે તેમના કોષો નિર્ણણ થવા માંડે છે, અકાળે વૃદ્ધ બનવા માંડે છે અને રોગોના લોગ ખનીને મોતનો કોળિયો બને છે.

આ એક સનાતન સત્ય છે કે માણુસ પોતાના ધોળા વાળને કાળા બનાવી શકતો નથી. તે યકૃત (લીવર), હૃદય અને ધમનીઓને નવાં બનાવી શકતો નથી. આમ હોવા છતાંથી સિતેર વરસની ઉંમરે પણ તે વિકારોથી હૂર રહીને તંહુરસ્ત રહી શકે છે. મેં કુદરતી પોપળું અને જૌતિક સંસ્કૃતિના લોકશિક્ષણું કાર્ય કરતી વખતે અનુભંગું છે કે વૃદ્ધાવસ્થા, નિર્જળતા કે માંદગીને લીધે જે હજરે લોકો અશક્ત હતા, તેમણે કુદરતી જીવન જીવવાની પદ્ધતિ અપનાવીને આશ્ર્યજનક સ્વરૂપે તંહુરસ્તી, ચુવાની અને સુખી જીવન મેળવ્યાં હતાં.

### કુદરત અને કુદરતના નિયમોના પાલનમાં નિષ્ફળતા કયાં ?

હૃતાશ થયેલા ધણાખરા લોકો આ કથનની સત્યતાના મહત્વને સમજતા નથી કે તે અ-કાળો જ વૃદ્ધ થઈ રહ્યા છે.

આપણે જોઈ એ છીએ કે કેટલાક લોકો ત્રીસ વરસની ઉંમરે જ વૃદ્ધ થઈ જાય છે અને કેટલાક પંચાતેર વરસની ઉંમરે પણ ચુવાન હોય છે. કુદરત આપધાત કરનારને કણરમાંથી બહાર કાઢી શકતી નથી. છેલ્લી સ્થિતિએ માંદગી પહોંચી જાય પછી તંહુરસ્તી મેળવવા માટે સખત અજૂમવું પડે છે અને સમયગાળો લંબાય છે. આપણું પાસે પણ મોટી ઉંમરે તંહુરસ્ત રહેવાના નિયમો અને સાધનો હાજર છે. જરૂરત છે કેવળ આ નિયમોનું પાલન કરવાની 'અને સાધનોનો ઉપયોગ કરવાની.



[ ૩ ]

## વૃદ્ધાવસ્થા શા માટે ?



વૃદ્ધાવસ્થાની જરૂરત નથી ? આપણે આ રીતે વિચારીએ છીએ. વૃદ્ધ થવાની વાતનો વિરોધ કરો. યુવાન બનો. તમે સમયને પરાજય આપી શકો છો ? સમયના વહેણુમાં તણાવાનું બંધ કરો. સાડ વરસની ઉંમરે પણ તમારી આંખો સારી રહી શકે છે અને તમે જીવનનો આનંદ લોગવી શકો છો. પંચોત્તેર વરસની ઉંમરે તમારા ચહેરા પર આનંદનો ચમકારો હુશો. પંચ્યાસી વરસની ઉંમર તમારા માટે ઘરેણાની જેમ આનંદદાયી હુશો. સો વરસની ઉંમરે તમે અદ્ભુત રીતે આશ્રીર્યપ્રદ દેખાશો અને આમાં આશ્રીર્ય જેવું શું છે કે તમે તમારા સવાસોમા જન્મહિન પ્રસંગે ચંદ્રલોકની યાત્રા કરવાનું વિચારતા હુશો ? તમને લાલદાયી રસ્તો પસંદ કરવાનું તમારા જ હૃથમાં છે. એક રસ્તો તમને માંદગી, અકાળે વૃદ્ધત્વ અને જીતની શુદ્ધ તરફ લઈ જાય છે. બીજો રસ્તો સંયમી જીવનનો છે. આ રસ્તો તમને હીરાયુષ્ય અને શાંતિમય જીવનના સર્વોચ્ચ શિખર તરફ લઈ જાય છે. તમારે આ

૧૭

એમાંથી એક રસ્તો પસંદ કરવાનો છે. જે તમે હીર્ઘાયુષ્ય પસંદ કરતા હો, તો તમારે આજથી જ નહિ, પરંતુ આ ઘડીથી જ સંયમી જીવનની શરૂઆત કરવી જોઈએ.

યુવાવસ્થા પ્રાપ્ત કરીને સવાસો વરસ સુધી શા માટે જીવતા ન રહેવું? તમારી પાસે ઈચ્છા છે અને શક્તિ પણ છે!!! તમારે અકાળે શા માટે વૃદ્ધ થવું? તમે હંમેશાં તમારી સાચી ઉંમરથી પાંચદશ વરસ વધારે ઉંમરના શા માટે હેખાએચો છો? પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી. જે કારણેને લીધે અકાળે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો વરતાઈ આવે છે, તે કારણો જ હું તમને જણાવી દઉં! તમે તમારી સાચી ઉંમર ફરીથી પાછી મેળવી શકો છો. તમારા શરીરનો ઉંમર સાથે મેળ મેળવી શકો છો. તમે તમારા શરીર અને ઉંમરની સમતુલા હંમેશ માટે જણવી શકો છો. તમે તમારી સાચી ઉંમરથી પાંચ કે દસ વરસ નાના હેખાઈ શકો છો. આ જ છે આપણું અંતિમ લક્ષ્ય. આ લક્ષ્યની પ્રાપ્તિને હું યુવાવસ્થાની પ્રાપ્તિ કરું છું. આપણે સૌ યુવાવસ્થા મેળવી શકીએ છીએ.

આ દિશામાં તમને મદદ કરવા માટે જ મેં આ પુસ્તક લખ્યું છે. તમને સારામાં સારી તંહુરસ્તી અને આનંદમય હીર્ઘાયુષ્ય મેળવવાની પ્રેરણા મળે એ જ મારો ઉદેશ છે. મારા ઉદેશને તમે પ્રેરણા પણ કહી શકો છો.

મારા માટે તો સારી તંહુરસ્તી, હીર્ઘાયુષ્ય અને આનંદ આ ગ્રણું ‘સત્યમ्, શિવમ्, સુનદરમ्’ છે.

શરીરને જ્યાં શાંતિપૂર્વક રહી શકાય તેવું  
પવિત્ર મંહિર બનાવો.

શરીરના શુલેચ્છક બનવાની મારી ઝરજ છે. હું  
તંહુરસ્તીના મંહિરનો પૂજારી છું. તંહુરસ્તી તમારો  
અમૂલ્ય લંડાર છે. તમારી સાચી સંપત્તિ (રોકડ રકમ,  
સંઘરો અને લૌતિક ધન)માં વધવટ થાય છે અને વપરાય  
પણું છે. પરંતુ તમારી તંહુરસ્તી એક અમૂલ્ય સંપત્તિ  
છે. આ સંપત્તિને તમારે જીવનમાં અન્ય લૌતિક ધન  
અને સંપત્તિના આનંદ અને સંપૂર્ણ ઉપલોગ માટે સુરક્ષિત  
રાખવાની છે.

આપણામાંથી ધણુાખરા લોકો આપણી અકાળ વૃદ્ધા-  
વસ્થાનાં કારણો જાણુતા હોઈએ છીએ. પરંતુ આપણે  
આપણી ટેવોના એટલા અધા શુલામ થઈ ગયા છીએ  
કે આપણી આ જાણુકારીને કાર્યાન્વિત કરી જ શકતા  
નથી. તમારે તમારા શરીરનું એવી રીતે ઘડતર કરવું  
નેઈએ કે તે તમારી આજા ખડેપગે ઉડાવે. શરીરે શું  
ખાવું અને શું પીવું નેઈએ તે પણ તમારે શરીરને  
જણુાવવું નેઈએ. જો એકાદ વાર પણ તમારું મન  
તમારા શરીર કરતાં વધારે ખળ્ણું સાણિત થાય, તો  
તમારે સમજ લેવું કે તમારું શરીર તમારા મગજના  
કાખૂમાં નથી. આપણે આપણા શરીર પર નિયંત્રણ રાખતાં  
શીખવું જ નેઈએ.

## અકાળે વૃષ્ટાવસ્થાનું એક કારણ : મળવિસર્જન શક્તિમાં શિથિલતા...

આપણું શરીર જીવતા રહેવા માટે ઓરાકમાંથી જરૂરી પોષણ મેળવી લે છે. બાકીનો ભાગ શરીરનાં જુદાં જુદાં અંગો (મળાશય, મૂત્રાશય અને ચામડીનાં છિદ્રા) મારફત શરીરની બહાર નીકળી જય છે. મળ-વિસર્જનનાં આ અંગો શક્તિશાળી અને યોગ્ય સ્થિતિમાં કાર્યરત હોય છે ત્યાં સુધી આપણે સંપૂર્ણ તંહુરસ્ત હોઈએ છીએ. પરંતુ જ્યારે કેચિક કારણસર મળવિસર્જનનાં આ અંગો ઓરાકના વધેલા ભાગને શરીરની બહાર ધકેલી શકતાં નથી, ત્યારે વધેલો ભાગ શરીરમાં જ જમા થાય છે. ઓરાકનો આ વધેલો ભાગ જેર જેવો હોય છે. શરીરની ગરણડનું સૌથી મોટું કારણ આ જેર જ હોય છે. આ જેર નસોમાં પ્રવેશીને રક્તાભિસરણુમાં ગોટાળોમોટાળો કરે છે. પચાસ વરસની આસપાસના માણુસો લોહીના પરિભ્રમણુંની આ ખામીને લીધે મરણુશરણ થાય છે તેનું મુખ્ય કારણ પણ આ જ છે.

માણુસનું શરીર ધમનીએા, નસો અને વાળ જેવી પાતળી શિરાએાની જળનું ગુંથાયેલું છે.

શરીરની મળવિસર્જનની શક્તિ એછી થઈ જય છે, ત્યારે શરીરમાં વિકારો રહી જય છે અને મળવિસર્જનનાં અંગો આ વિકારોથી અળગાં રહી શકતાં નથી. આ કારણને લીધે શરીરનું સ્નાયુતંત્ર ભારેખમ અની

નાય છે અને શરીરમાં કેટલીય જાતના રોગ ધર કરી એસે છે. શરીરની મળવિસર્જનની શક્તિ મંદ પડવાને લીધે શરીરનો વિકાર સનાયુએ અને સુખ્ય અંગોમાં પ્રવેશે છે. શરીરની જીવનશક્તિ વિકારોમાંથી છુટકારો મેળવવા માટે અથાગ પ્રયત્નો કરે છે. આ બધું જેર હુલકા-ભારે જવર (તાવ) દ્વારા કે ગળા અને નાકમાંથી ચીકણા પ્રવાહી દ્વારા બણાર નીકળે છે. હુરકોઈ બીમાર વ્યક્તિના શરીરમાં એડા કે વધારે વિકારોની હૃયાતી હોય છે. આ વિકારોની ઉત્પત્તિ પાચન થયા વિનાનાં વિજલીય દ્રોગો શરીરમાં એકઢાં થવાથી થાય છે. લાંબા સમય સુધી શરીરમાં ધીરે ધીરે એકઠો થયેલો અકુદ્રતી ખોરાક પણ આ વિકારોના કારણુંથૐપ છે.

શરીરના સનાયુએ અને અંગોમાં એકહું થતું આ જેર હુંમેશાં નવા નવા રોગોને જન્મ આપે છે. માણુસ પોતાનાં શારીરિક હુઃપોતા કારણું હુર કરવાને બદલે તેના પરિણામને હુર કરવાનો પ્રયત્ન કરે છે. જે તેને માથાનો હુઃઆવો હોય તો તે માથાનું હુઃખ હુર કરવાની દિચ્છા રાખે છે. તે માથાના હુખાવાનું કારણ જાણવાની દિચ્છા રાખતો નથી. તે તો તેમાંથી છુટકારો મેળવવાની જ દિચ્છા રાખે છે.

ધણુાખરા માણુસોને તેમનાં શારીરિક પાપોનાં પરિણામે જ રોગ ઝૂપે શિક્ષા થાય છે. આવા લોકો પોતાનાં હુઃખ-તકલીફી હુર કરવા માટે ઉત્તાવળ કરે છે. જે કારણોને લીધે આ હુઃપો (રોગો) અને અકાળે વૃદ્ધાવસ્થા

આવી હોય છે, તે કારણુંને હૂર કરવામાં કે જીવન-પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવા માણુસોને રસ નથી. આદેકો તો રોગનાં લક્ષણોમાંથી જ છૂટવા હશે છે.

### પ્રત્યાધાતનો સિદ્ધાંત

મને પ્રત્યાધાત(Re-action)ના સિદ્ધાંતમાં અક્રમ શ્રદ્ધા છે. ગમે તે પરિણામના કારણ પર અટલ શ્રદ્ધા છે. રોગોનું કારણ જીવન પસાર કરવાની જોઈ રીત છે. તમે જ્યાં સુધી જોઈ રહેણું કરણું નહિ કરો, ત્યાં સુધી તમારા શરીરની અભ્યવસ્થાને નહિ મિટાવી શકો. અકાળે પધરામણી કરતી વૃદ્ધાવસ્થાને પણ તમે હૂર નહિ હડસેલી શકો. ધણાખરા માણુસો પોતાના શરીર પર નિયંત્રણ રાખી શકતા નથી. આ કારણુંને લીધે શરીર મનતું શુલામ બની જય છે. મનની આ સત્તાને લીધે તે શરીરને માર્ગદર્શિન આપતી વખતે અત્યાચાર શુલરે છે. આ પાપના પ્રત્યાધાતરૂપે માંદગી આવે છે અને છેવટે મરણ થાય છે.

તંહુરસ્ત, શક્તિશાળી અને રોગ વિનાના શરીર માટે તમારે જીવનશક્તિને એવી રીતે કેળવવી જોઈએ. કે તમારા શરીરના મળવિસર્જનના પ્રત્યેક અંગને વિકારોથી હૂર રાખવામાં આવે. આંતરિક વિકારોથી લદાયેલી નસો અને અંગો સાથે તમારી તંહુરસ્તી સારી રીતે ન જ જળવાઈ શકે. તંહુરસ્ત અને પવિત્ર શરીરમાં જ સારામાં સારી તંહુરસ્તી પ્રાપ્ત કરવાની શક્તિ છે.

## શરીરમાં નવસર્જન અને રોગમુક્તા કરવાની શક્તિ છે.

રોગોમાંથી છુટકારે મેળવવો એ શરીરની એક આંતરિક શક્તિ છે. સારી તંહુરસ્તી અને કુદરતી જીવનની ભર્યાદાને લોગવવા માટે લોહી અને શરીરને શુદ્ધ રાખવાની ખાસ જરૂરત છે. ગંભીર રીતે પ્રયત્નો કરીને જ તમે સારી તંહુરસ્તી મેળવી શકો છો. તમારે કુદરતના નિયમોને જાણી લેવા જોઈએ અને તમારા રોજિંદા જીવનમાં આ નિયમોનું પાલન કરવું જોઈએ.

હું તમને તંહુરસ્તીના નિયમો શીખવી શકું છું અને આ નિયમો પાળવાની રીત પણ જણાવી શકું છું. પરંતુ હું રોગને ફર કરવાનું સાહુસ કરી શકતો નથી, કારણ કે જીવાંત્ પ્રાણીઓમાં રોગમુક્ત થવાની કુદરતી શક્તિ હોય છે. હૃષિત ખાદ્ય વાનગીઓથી શરીરની વખાર ભરવાનું બંધ કરી હો. શરીરને કુદરતી ખોરાક જ આપો. તમારી જીવનશક્તિના પ્રવાહને તમારે એવી દિશાએ વાળવો જોઈએ કે તે તમારા શરીરના વિકારો અને મળને હંમેશાં બહાર ધકેલો. આ વિકારો જ શરીરને રોગિઠ બનાવે છે. બીજું કોઈ તમારા શરીરને પાપમાંથી બચાવશો એવી આશા જ ન રાખશો. તમે જો સંપૂર્ણ તંહુરસ્ત અને લાંબા જીવનની આશા રાખતા હો, તો તમારે શારીરિક પાપ આચરવાનું બંધ કરવું જોઈએ.



[ ૪ ]

## ઉપવાસથી જ આરંભ કરો



તમે તમારા શરીરને આરામ કરવા હો ! આરામ કરવાથી જીવનશક્તિને કામ કરવાની તક સાંપડશે અને તે અંદરથી સફ્ટાઈ કરી શકશે. ધણાખરા માણુસો શરીરને સશક્ત બનાવવા માટે આપો હિવસ ખાધા જ કરે છે, પરંતુ આ એટી પદ્ધતિ છે. જે તમે આપો હિવસ કંઈ ને કંઈ ખાધા જ કરો તો તે અંદરની સફ્ટાઈનું કામ જ ન કરી શકે કારણ કે તેને પોતાની શક્તિનો વ્યય એરાક પચાવવા માટે જ કરવો પડે છે. તમારું શરીર જેટલું શુદ્ધ અને સ્વચ્છ હુશે તેટલી જ તમારામાં જીવનશક્તિ વધારે હુશે.

જીવનશક્તિને જથ્થત કરવા અને તેને સશક્ત બનાવવા માટે તમારે ત્રણ હિવસની દૂંકી મુદ્દતના ઉપવાસ કરવા. ઉપવાસ હરમિયાન ઉકાળેલું શુદ્ધ પાણી પીવું. કેટલાક લોકો સામાન્ય પાણી જ પસંદ કરે છે. પાણીમાં લીંખ અને મધ્ય મેળવીને ઠંડું કે ગરમ લઈ શકાય.

તમે ઉપવાસ કરો છો, તે સમયે કુદરતના ‘શાલ્ય મંચ’ (ઓપરેશન ટેબલ) પર હો છો ! આ સમયે તમારી

જીવનશક્તિ વિકારોને હુર કરવા પર જ કેન્દ્રિત હોય છે. ઐરાક લેવાનો ચાલુ હોય છે, ત્યારે તમારી જીવનશક્તિ ઐરાકને પચાવવા અને વધારાના ઐરાકને બહુર કાઢવામાં જ પ્રવૃત્ત હોય છે. પરંતુ જ્યારે તમે ઉપવાસ કરો છો, ત્યારે તમારી પાચનશક્તિ શારીરિક સ્વચ્છતાના કાર્યમાં જ રોકાયેલી રહે છે.

ઉપવાસ કરવાથી તમે અશક્ત બની જશો અને તમને કેટલીક તકલીફી પણ પડશે. પરંતુ સારી તંહુરસ્તી માટે તમારે કંઈક ને કંઈક કીમત તો ચૂકવવી જ પડશે. ઘણ્યુખરા લોકો ઉપવાસ પસંદ કરતા નથી. કેટલીક ગંભીર તકલીફી સહન કરવા છતાંય તેમનું સામાન્ય જીવન રગણિયા ગાડાની જેમ ચાલ્યા કરે છે. શારીરની શુદ્ધિ માટે ત્રણ દિવસના ઉપવાસની શરૂઆત ફળ અને ગાજરના રસના કુદરતી ઐરાકથી જ કરવી જોઈ એ.

ધૂમ્રપાન, શરાબ, ચા, કોકી, કોકો અને મીઠાનો ઉપયોગ બંધ કરો. રાસાયણિક તત્વોની મેળવણીથી બનાવેલી વાનગીઓ અને સઝેદ લોટ અને મેંદામાંથી બનાવેલી વાનગીઓનો ઉપયોગ ન કરવો. સઝેદ ખાંડ ન લેવી. લાલ ખાંડમાંથી બનાવેલી વાનગીઓનો ઉપયોગ પણ ઓછામાં આછો કરો. ખાંડ જેવા પહારેનો ત્યાગ કરીને તમારે કુદરતી ઐરાક જ લેવો જોઈ એ.

### કુદરતી ઐરાક લો

તમારા ઐરાકનો હું લાગ તાજાં ફળ અને કાચાં સવાસો વરસ ૪

શાકલાળું અને સલાડનો હોવો જેઈએ. માણુસના લલા માટે કુદરતે તેને જે તત્ત્વો આપ્યાં છે, તે બધાં જ તત્ત્વો તાજાં ઇણ અને કાચાં શાકલાળમાં હોથ છે. તમે જમવામાં પાકાં ઇણ અને કાચાં શાકલાળના સલાડનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના ઝોરાકમાં કુદરતી લુધનતત્ત્વો, ઘનીલે અને કીમતી પોપક તત્ત્વો તેના મૂળ સ્વરૂપમાં હોય છે. આ તત્ત્વોની શરીરને આવશ્યકતા હોય છે. માણુસનો આ કુદરતી ઝોરાક છે.

### પાચનમાં ભૂખનું મહત્વ

ઝોરાકને મોંમાં ધીરધીરે ચાવવાનું રાખો. ધીરધીરે ચાવવાથી અંથિઓમાંથી લાળ નીકળીને ઝોરાકમાં લણે છે. સામાન્ય લોકોની નજરે આ બાણત ખાસ મહત્વની નથી, પરંતુ પાચનકિયા માટે આ બાણતનું આગવું મહત્વ છે. ઝોરાક ચાવતી વખતે જે રસ નીકળીને ઝોરાકમાં લણે છે, તે ઝોરાકની સાથે જઠરમાં જઈને ઝોરાકને પચાવવામાં ખાસ મદદરૂપ થાય છે.

### હોરેસ ફ્રોન્ટર પાસેથી હું શું શ્રીખ્યો?

હું લંડનમાં હતો ત્યારે મે, ૧૯૧૭ના વર્તમાન-પત્રમાં મેં એક સમાચાર વાંચ્યા : ‘હુનિયાની સૌથી શ્રીમંતુ વ્યક્તિ રોક્ફેલર ઝોરાકના નિયમોમાં ફેરફાર કરીને સો વરસ જેટલી ઉંમરે પહોંચવાની તૈયારીમાં છે.’ આ લેખમાં ઝોરાક સંબંધી નિયમોની વ્યાખ્યા બાંધતાં એક જગ્યાએ આ પ્રમાણે લખયું હતું : ‘જમવાનું પૂરું કરવાની ઉતાવળ

કરશો નહિ. કોઈક મનપસંહ વિષય પર ચર્ચા કરતાં કરતાં ખોરાકને ધીરેધીરે ચાવીને ખાઓ. ખોરાક ચાવવા માટે હાંતને સમય આપો અને ભૂળને સારી રીતે જિઘડવા હો.'

મેં ન્યૂયોર્ક આવીને ફ્લેચરની સુલાકાત લીધી

ઇંગ્લેન્ડથી પાછા ફરતી વખતે મને હોરેસ ફ્લેચરના સહપ્રવાસી થવાનું સહભાગ્ય પ્રાપ્ત થયું. મારી જેમ જ વહૃણના ડેક પર ટહેલતાં દરિયાના પવનની મોજ માણુવાનો ફ્લેચર સાહેબને પણ શોઅ હતો. ડેક પર લટાર મારતી વેળાએ જ અમારી સુલાકાત થઈ. ન્યૂયોર્કથી પાછા ફરતી વખતે સાત જ દિવસમાં મને ફ્લેચર પાસેથી જે શીખવા મળ્યું તે ખૂબ જ કીમતી છે. તેમના શરૂઆતે મારા પર આશ્રીંજનક અસર કરી અને દીર્ઘયુષ્ય માટે મહદ્રાય પુરવાર થયા.

વાતચીત દરમિયાન ફ્લેચરે કહ્યું: 'હું ચાળીસ વરસનો હતો ત્યારે મારું વજન ૨૧૭ પૌંડ (રતલ) હતું. સાડાપાંચ કૂટની જાંચાઈવાળા માણુસ માટે આ વજન ધણ્યું વધારે કહેવાય. મારા વાળ ધોળા થઈ ગયા હતા અને શરીરની શક્તિઓ કીણું થઈ ગઈ હતી. દર છ મહિને અપચો અને ધન્યલુચેન્જાથી પીડાતો હતો. હું થાકી જતો હતો. ચાળીસ વરસની ઉંમરે તો હું વૃદ્ધ થઈ ગયો. હતો અને વધારે વૃદ્ધાવસ્થા તરફ જડપથો આગળ વધી રહ્યો હતો.'

શ્રીમંતું હોવા છતાંય મારી શારીરિક સ્થિતિને લીધે

હું વીમા ઉત્તરાવી શક્યો નહોતો. પૈસાડાર હોવાને લીધે આ દુનિયાના જે ચિકિત્સાલય(દવાખાના)માં મને તંડુરસ્તી પ્રાપ્ત કરવાની સહેજ પણ આશા નજરે પડતી લાંહું જઈ આવતો. પરંતુ તંડુરસ્તી મેળવવાના રેઝિંદા કાર્યક્રમમાં કુદરતી સમતુલા ન હોવાને લીધે મને નિરાશા જ સાંપડી. મારા જીવનમાં હંગલેંડના એક રાજ્યપુરુષ વિલિયમ ઈવિટ ગ્લેડસ્ટોનની એક ચોપડીએ કાંતિ આણી. આ ચોપડીમાં તેમણે ઓરાક વિશે એક સિદ્ધાંત અપનાવ્યો. હતો, ‘એક-એક કોળિયાને એટલો બધો ચાવવો જોઈએ કે તે વગર પ્રયત્ને જ ગળાની નળીમાંથી નીચે ઊતરીને જડ્યામાં પહોંચ્યી જય....’

ગ્લેડસ્ટોનના પંચસૂત્રી સિદ્ધાંતને અનુસરતું જીવન જીવિને ફ્લેચરે નવજીવન પ્રાપ્ત કર્યું. પાંચેય સિદ્ધાંતોનું પાંચ મહિના સુધી લાગલાગટ પાલન કરવાથી તેના જીવનમાં આશ્ર્યેજનક ફેરફાર થયો. તેનું મગજ તાજુંમાજું થઈ ગયું, વજન ચોવીસ પૌંડ (રતલ) ઓછું થઈ ગયું અને શારીરિક થકાવટને ‘જનમટીપ’ મળી ગઈ! તેમને ફરવા જવામાં અને શરીરની કસરત કરવામાં આનંદ થવા માંડ્યો.

**ઓરાક વિશેના ગ્લેડસ્ટોનના પાંચ નિયમો**

- (૧) જમતાં પહેલાં સારી ભૂણ લાગે તેની રાહ જુઓ.
- (૨) ઓરાકને તેના કુદરતી સ્વરૂપમાં જ લો. ઓરાક રસદાર હોવો જોઈએ અને તેમાં કોઈ ફેરફાર ન કરેલો હોવો જોઈએ. ઓરાકમાં ફળ અને તાજાં શાકભાજુનું પ્રમાણ વધારે હોવું જોઈએ. શાકભાજુને રાંધવાં ન જોઈએ.

(૩) ખોરાકને ધીરેધીરે મોંભાં ચાવીને તેનો સ્વાદ માણુવો જોઈએ. ખોરાક સહેલાઈથી નીચે ઉતરી શકે તેવો થાય ત્યારે જ નીચે ઉતારવો.


(૪) તૃપ્તિ થાય ત્યાં સુધી ખોરાકનો સ્વાદ લેવો જોઈએ. જમતી વખતે નિરાશાજનક વિચારોને તમારાથી ફૂર જ રાખો.

(૫) તમારી ભૂખ કે રુચિ પ્રમાણે જ ખોરાક લો. આ ખોરાકથી તમને સંતોષ થશે.

ખોરાકના આ પાંચ નિયમોનું પાલન કરવાથી તમે એક નવું જ જીવન પ્રાપ્ત કરશો. હું તમને તમારા પેટ પર લાર નહીં જ નાખવા હડિં. તમે જ્યારે ખોરાક વિશેના આ પાંચ નિયમોનું પાલન કરેા છો, ત્યારે તમારા શરીરમાં જરૂર કરતાં વધારે ખોરાક જતો નથી. આ કારણેને લીધે તમારા શરીરમાં વધારાના વિકારો પેઢા થતા નથી. ઘણુઅરા માણુસો કાંટા-ચમચાથી જ તેમની કબર ખોઢે છે.

વિજાને સાબિત કર્યું છે કે ખાઉધરા માણુસો લાંબું જીવતા નથી. સામાન્ય રીતે વોડહોડમાં પાતળો વોડો જ 'વીન'માં જય છે. આપણે સો વરસ જીવવાની આશા રાખતા હોઈએ, તો આપણું ખોરાકનો એક-એક કોળિયો. સારી રીતે ચાવવો જોઈએ. જરૂરત કરતાં વધારે ખોરાક શરીરને જીવંત ઊરથી ભારડૂપ બનાવી મૂકે છે.





[ ૫ ]

## ફ્રેલેચરના કેટલાય અનુયાયીએ દીર્ઘાયુષી બન્યા

છેલ્લા ૫ ચાવન વરસથી ફ્રેલેચરના નિયમોને અનુસરીને જેમણે સંપૂર્ણ તંહુરસ્તી અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કર્યાં હોય એવા કેટલાય લોકોને હું એળખું છું. જમતો વખતે ધીરે ધીરે ચાવીચાવીને ખાવાતું હોય છે. આ રીતે ખાવાથી એસાક વગર પ્રયત્ને જ ગળા નીચે જિતરી જાય છે.

ફ્રેલેચરનો મુખ્ય શિષ્ય હતો જે. એચ. કેલાગ. તેણું એટિલ થીકમાં ‘ચિકિત્સાતથ’(દ્વારાખાના)ની સ્થાપના કરી હતી. સો વરસની ઉંમર સુધી તે વાઢકાપના સફળ દાક્તર તરીકે જ્યાતનામ હતો! જેમ હોકિન્ગ એકસેને એક વરસ સુધી જીવ્યો હતો.

ક્રિસ્ટમ જગતની પ્રસિદ્ધ તારીકા રેનાદ્રૂઝને ફ્રેલેચરની લોજનપદ્ધતિમાં અટલ શ્રદ્ધા હતી. તે બધા જ કુદરતી નિયમોનું પાલન કરતી હતી. તે અઠચાસી વરસ સુધી જીવતી રહી. ભરણુની છેલ્લી ઘડી સુધી તે તંહુરસ્ત, સન્નગા અને ચૈતન્યશીળ હતી.

શિકાગેનો એક પોષણુશાખી સો વરસ જીવ્યો હતો. તે ફ્રેલેચરનો અનુયાયી હતો.

## જીવનને નિયંત્રિત કરતાં ત્રણું જરૂરી તત્ત્વો

પોષણ, ગતિ અને પ્રાણવાયુ-આ ત્રણું કુદરતી નિયમો દ્વારા જ આ જગતનાં બધાં જીવધારીઓનું નિયંત્રણ થાય છે. પરંતુ મનુષ્યો માટે આ નિયમોમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યો છે. આમ હોવાં છતાંથી તેના મૂળમાં આ ત્રણું નિયમોની છાપ હોય છે. કુદરત મનુષ્યના જીવનનું નિયંત્રણ ઓરાક, વ્યાચાર અને શ્વાસોચ્છ્વાસ મારાકત કરે છે. માનવજીવનની સૌથી મોટી સમસ્યા માનવીય પોષણની છે, કારણું કે માનવશરીરમાં પ્રત્યેક સેકંડે ૨૫૦૦,૦૦૦ લાલ કણોની ઉત્પત્તિ થાય છે. આ બધા કણોં એંસી દિવસમાં ફરીથી નવા બને છે. આપણું શરીર હંમેશાં બદલાયા કરે છે. આવતી કાલ માટે આપણું આપણા શરીર માટે હાડકાં, લોહી અને માંસપેશીઓનું ઘડતર કરવાનું છે. આવતા મહિનાની શારીરિક તંહુરસ્તોની જવાખદારી આપણી જ છે, કારણું કે હાડકાં, લોહી અને માંસપેશીઓનું નવસર્જન આપણું ઓરાક લેવાની ટેવ પર આધાર રાખે છે.

વ્યાવહારિક પોષણશાસ્ક્રના શફ્ટોમાં આનો અર્થે એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઓરાકની પસંદગી કરીને રક્તાસંચાલનને એંસી દિવસમાં નિયમિત બનાવો શકે છે.

પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શારીરિક અંયવસ્થાનું મૂળ કારણ અકુદરતી ઓરાક છે. કુદરતે ખષેલા પોષણના

મહાત્વને ધણીખરી વ્યક્તિઓ સારી રીતે સ્વાકારતી નથી. આ લોકો પંચસૂત્રી સિદ્ધાંતનું પાલન કરતા નથી. કુદરતી ખોરાક શારીરિક અવ્યવસ્થાને ફૂર કરે છે એટલું જ નહિ, પરંતુ શરીરની ધણીખરી તકફીહોમાંથી પણ છુટકારે કરાવે છે.

### આકાળ મૃત્યુનું કારણ

વેપારી ધૈરણે ચાલતાં વર્તમાનપત્રો, સામયિકો, ટેલિવિજન, રેડિયો અને અન્ય સાધનો મારફતે ખાદ્ય પદાર્થોની જહેરાતો થાય છે. આ જહેરાતો વાંચીસાંભળીને માણુસ આ અકુદરતી અપોષક ખોરાક તરફ આકર્ષય છે. સામાન્ય રીતે બહુમતી માણુસો કુદરતી પોષણુથી અજાણ હોય છે. આ રીતના નિઃસ્તવ પોષણુહીન ખોરાકમાંથી તમે નવું લોહી ઉત્પન્ન થાય એવી આશા કેવી રીતે રાખી શકો ?

### સાહસિક અને ધૂની જ કુદરતી ખોરાક લે છે

જે કુદરતી ખોરાકનો પ્રથમ પુરસ્કર્તા હોય છે અને કુદરતી ખોરાકના મહૃત્વની વ્યાખ્યા બાંધતી વખતે અકુદરતી અને કૃત્રિમ ખોરાકના છીછરાપણું પર સખત ટીકાઓ કરે છે, તેને દણાવી હેવા માટે આવા ખોરાકોના નિર્માતાઓ પ્રચાર અને અન્ય સાધનોના માધ્યમથી લાગ્યો ઝિપિયા ખર્ચ કરે છે. આ નિર્માતાઓ કુદરતી ખોરાક બિશે જૂઠાં અને ભ્રામક તથ્યોવાળાં ભાષણું આપનારા વિચકણું પ્રચારકોને પ્રચાર માટે રોકે છે. આ પ્રચાર ભ્રામક જ હોય

છે. સામાન્ય માણુસ આ 'ગોળેવસ'ના શખ્ફોમાં વિશ્વાસ મૂકે છે. પરંતુ તે ઠંડા ભગલે એટલો વિચાર નથી કરતો કે આવો અકુદૃતી, અપોષક, તત્ત્વહીન અને મરેલો ખોરાક આરોગીને (!) કેટલા માણુસો શતાયુ થયા છે ?

### હરકોઈ વસ્તુમાં કંઈક સાર છે

જે ખાદ્ય પદાર્થોનું વ્યાપારી દર્શિકાણુથી ઉત્પાદન થાય છે, તેમાં કોઈ ને કોઈ વિશિષ્ટતા રાખવામાં આવે છે. આ વિશિષ્ટતાને લીધે થાહુક તેના તરફ આકર્ષય છે. વ્યાપારવિષયક વિશિષ્ટતાને નામે ખાદ્ય પદાર્થોમાં રાસાયણિક પ્રક્રિયાના માધ્યમથી ઘનતા, ફીણુ, રંગવિહીનતા અને ખાસ રંગયુક્ત એવાં વિશેષણો લગાડવામાં આવે છે. નિશ્ચિત સમયમર્યાદા સુધી ખાદ્ય પદાર્થો બગડી ન જાય તેટલા માટે તેમાં ખાસ ફેરફાર કરવામાં આવે છે. એક ખાદ્ય પદાર્થની બનાવટમાં પાંચથી હસ જેટલી વસ્તુઓની મેળવણી થાય છે. આ બધું કર્યા પછી પણ જાણુકારો એમ કહેતા સંભળાયા છે કે આ બનાવટી ખાદ્ય પદાર્થોથી ચેતતા રહેને, કારણુ કે તેની બનાવટમાં તીવ્ર રાસાયણિક ફેરફારો કરવામાં આવ્યા છે. થાહુક વસ્તુઓ ખરીદે છે ખરો; પરંતુ એટલું નથી પૂછતો કે આમાં કઈ કઈ વસ્તુઓ મેળવેલી છે ?

આ પ્રકારના વાતાવરણ પછી પણ મનુષ્ય સારી તંહુરસ્તી અને હીધર્યાય્યની ઈચ્છા રાખે છે. માણુસ જ્યાં સુધી આ કૃત્રિમ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ બંધ કરીને

કુદરતી ઓરાક તરફ નહિ વળે, ત્યાં સુધી તે હીરાયુષી જીવન પસાર નહિ કરી શકે. તે પાંત્રીસ વરસ જેટલી નાની ઊંમરે જ આ ફુનિયામાંથી અલવિદા કરશે.

**ભનાવટી અને મેળવણુવાળો ઓરાક ન લેવો**

જો તમે સારી તંહુરસ્તી અને લાંખું આચુષ્ય લોગવવા ઈચ્છતા હો, તો બ્યાપારી ઘોરણે ભનાવાતા ખાદ્ય પહાર્થી પરનું લખાણ અવશ્ય અને જીણુવટથી વાંચી જાયો. હુકાનોમાં વેચાતી કૃત્રિમ અને લેળસેળવાળી ખાદ્ય વસ્તુઓ કચારેય ન ખરીદશો.


**યૌવનસુલલ, સર્વોત્તમય અને લાંખા જીવન  
માટે કુદરતી ઓરાક**

આજથી પચાસ વરસ પહેલાં મેં ઓરાકના પ્રક્રના અભ્યાસની શરૂઆત કરી. તે જમાનામાં આ વિષય પરત્યે અજ્ઞાનતા જ પ્રવર્તતી હતી. સામાન્ય જનસમાજ ખાદ્ય પહાર્થીના મહુત્વનો સ્વીકાર જ નહોંતો કરતો. મેં કુદરતી તત્વોવાળા ઓરાકનું સંપૂર્ણ જ્ઞાન ડો. એણ્ઝસ્ટ રેલિયર પાસેથી મેળજું. હું માંદો પડીને સ્વીદજર્લેન્ડના તેમના દ્વારાખાને પહોંચી ગયો. તેમણે મને ફરીથી તંહુરસ્તી બદ્ધી. તેમણે તેમની કુદરતી સારવારની પદ્ધતિ પ્રમાણે જ સૂર્યનો પ્રકાશ, શુદ્ધ પવન, ઊંડો શાસોચ્છ્વાસ અને કસરત-મારી કથળેલી તંહુરસ્તીમાં નવસંચાર કર્યો. પોણાયુક્ત ઓરાક પણ અરો જ. ત્યાં હું ફળ અને લીલાં શાકલાણ સલાડના સ્વરૂપમાં ખાતો. મને બદ્દાટાની જેમ-

ઉકળેલો છોડાવણો જોરાક જ આપવામાં આવતો. મેં ખધી જ જતના ગર (અંદરનો માવો), બીજુ, સૂકો મેવો અને રોટલીનો જોરાક લીધો. કુદરતી જોરાકે મને ડેવળ તંહુરસ્તી જ ન ખક્ષી, પરંતુ ખેલકૂદની હરીકાઈમાં ભાગ લઈને ઈનામ પણ મેળવી આપ્યું. ઈ. સ. ૧૬૦૫માં શારીરિક સાંસ્કૃતિક આંદોલનના પિતા બન્સર મેકેઝેડને ચોજેલી ‘તંહુરસ્ત અને શક્તિશાળી માણુસોની હરીકાઈ’માં ભાગ લઈને મેં બીજું ઈનામ પણ મેળવ્યું. આ હરીકાઈની પૂર્ણાઙુત્તિ પછી ‘જગતના તંહુરસ્તી યુદ્ધના આંદોલન’માં હું મેકેઝેડન સાથે જોડાઈ ગયો.

મારે અને મેકેઝેડનને સારી એવી ટીકાઓ સાંભળવી પડી, પરંતુ કુદરતી જોરાકના મહત્વનો પ્રચાર કરવાનું બંધ ન કર્યું. લોકોને અમારા શર્ષ્ટો પર વિશ્વાસ બેસતો નહોતો. અમે કુદરતી જોરાકના માધ્યમથી સારામાં સારી તંહુરસ્તી મેળવી હતી. અમને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે જ્ઞાન(સત્ય)ના સૂર્યના પ્રકાશને ટીકાકારોનું અજ્ઞાન આવરો શકે તેમ નહોતું. એક દિવસ એવો આવવાનો જ છે કે જ્યારે અમારો સિદ્ધાંત સર્વમાન્ય અનશો. તે સમયે અમે ધમધોકાર પ્રચાર કરીને અમારા ટીકાકારોનાં મેં બંધ કરી હીધાં. અમે પ્રતિજ્ઞા પણ લીધી કે આ જ રીતે ભવિષ્યમાં પણ અમે અમારા ટીકાકારોનાં મેં બંધ કરીશું. અમે કુદરતી જોરાકનો પ્રચાર ચાલુ રાખ્યો.





[ ૬ ]

## પોષણું આગવું સ્થાન

મને સંપૂર્ણ સંતોષ થાય છે કે કેટલાય ચિકિત્સકોએ કુદરતી પોષણુના મહત્વનો સ્વીકાર કર્યો છે. કુદરતી ઝોરાકોમાં ખનીજ, મીહું અને ક્ષારો તેના ભૂળ કુદરતી સ્વરૂપે મળી આવે છે. આ કારણુને લીધે કેટલાય પ્રગતિ-શીલ ચિકિત્સકો દ્વારે બદલે ખનીજ દ્વારા અને ક્ષારયુક્ત કુદરતી ઝોરાક લેવાની લલામણું કરે છે.

## ઝોરાક વિશેના નિયમો

(૧) ખરેખરી ભૂખ લાગે ત્યારે જ ઝોરાક લો. કુદરતી ઝોરાક ભૂખ લાગે ત્યારે જ રૂચિયુદ્ધ નીવડે છે.

(૨) જમવાના સમયે ખરેખરી ભૂખ ન લાગે તો ભૂખ લાગવાની રાહ જુઓ, કારણ કે ભૂખ વિના ખાખેલો. ઝોરાક જેરીલો અની જય છે.

(૩) ખોરાકને મોંમાં સારી રીતે ચાવો. ખોરાકના કેળિયામાં લાળ ભળીને નરમ બનાવો. પછી ખોરાક આપમેળે જ ગળામાં નીચે જિતરી જશો.

(૪) સૂપ, ફુથ અને લસ્સી જેવા પેય પદાર્થને ધીરેધીરે ચૂસીને પીવા જેઈએ. આમ કરવાથી તેમાં પણ રસ ભળશે.

(૫) જરૂરી મીઠું, ખનીજ તત્વો, જીવનતત્વો (વિદ્યાભિનો) અને પૌષ્ટિક તત્વોવાળો કુદરતી ખોરાક લો.

(૬) જમતી વખતે કેટલાય પ્રકારની વસ્તુઓ ભાણુમાં ન લેવી. તેમ કરવાથી ખોરાક વધારે પ્રમાણુમાં લેવાય છે. આ વધારાનો ખોરાક શરીરમાં ઊર ઉત્પન્ન કરે છે.

(૭) એ માંસાહારીઓની પાચનશક્તિ સારી ન હોય, તેમણે માંસ સાથે રોટલી અને બદામને બદલે સલાડ, ફળ અથવા સ્ટાર્ચ વિનાના પદાર્થનો વપરાશ કરવો જેઈએ.

(૮) ખોરાકને ખોટી પદ્ધતિથી રાંધીને તેનાં ખનીજ તત્વો અને ક્ષારોનો નાશ ન કરશો. તેને ઓછા પાણીની વરાળથી રાંધેં કે શેકે.

(૯) ખોરાક રાંધવામાં કાચ, સ્ટીલ કે માટીના વાસણોનો ઉપયોગ કરો.

(૧૦) નખળી પાચનશક્તિવાળા માણુસોએ કેટલીક વસ્તુઓની મેળવણી કરીને ખાવી જોઈએ, ધીરેધીરે સ્ટાર્ચ વિનાનાં શાકભાજુનો વપરાશ વધારવો જોઈએ. ત્યારણાં પાકાં ફળ, કચૂંખર અને ટામેટો જેવાં ફળનો ઉપયોગ કરવો જોઈએ.

(૧૧) ખોરાકની સાથે ધીરેધીરે ઘૂંટડીએ ભરીને ચા પણું પી શકાય.

(૧૨) શક્ય હોય ત્યાં મીહું અને મસાલા નાખીને ખોરાકનો સ્વાદ ન બગાડો.

(૧૩) દીર્ઘયુષ્ય માટે પેટમાં ડાંસીને ખોરાક ન લરશો. ખોરાકનું પ્રમાણ વધારે જણાય કે વધારે ખાવાની ઈચ્છા થઈ આવે ત્યારે ભાણું પરથી જિલા થઈ જવું.

(૧૪) તાંન અને સૂકાં ફળ સંપૂર્ણ તંહુરસ્તી અન્ધે છે.

(૧૫) સ્કૂર્ટી મેળવવા માટે એ વખતના લોજન વચ્ચે ફળોનો ઉપયોગ કરી શકાય.

(૧૬) અડધું ખાંધા પછી એક ખાંદો પાણી અને આખા દિવસ દરમિયાન છ-સાત ખાલા પાણી પીવું જોઈએ.

## ટેવો પર નિયંત્રણ

આપણું પર ખોરાકની આદતોનું નિયંત્રણ છે. આ જીવનની સૌથી મોટી શક્તિ છે. તેના પર જ આપણી શારીરિક અને માનસિક શક્તિનો આધાર છે. નિયમિત અદ્યપાહૃત અને અપોર-સાંજનું લોજન તંહુરસ્તી માટે જરૂરી છે. પરંતુ આપણે ગમે તે સમયે ખાવાની શુલામી બોગવીએ છીએ. આ શુલામીમાંથી છુટકારો મેળવો.

જમવાનો સમય થાય ત્યારે તમે ભૂખ્યા હો અને તમારી મનપસંહ વાનગીએ હોય તો તમે સમયનો ઘ્યાલ કર્યા વિના જ લોજન લઈ શકો છો. આ સમય સવારના છ વાગ્યાનો પણ હોય અને રાત્રિના દસ વાગ્યાનો પણ હોય. જમવાના સમયે કડકીને ભૂખ લાગી હોય તે જરૂરનું નથી; પરંતુ ખોરાક પચાવવા માટે સાધારણ ભૂખ લાગી હોય તે જરૂરનું છે જ.

## શરાખ અને તંહુરસ્તી

પારીએ અને પરિષ્ઠદોમાં સામાન્ય રીતે શરાખને જરૂરી લેખવામાં આવે છે. કેટલાક લોકોની જીવનશક્તિ એટલી બધી નિર્ભળ અને ક્ષીણ હોય છે કે તેમને હંમેશાં શરાખનો આશરો લેવો પડે છે. જે શરીરનું કુદરતી ખોરાકથી પોખણું કરવામાં આવે, તો સ્કૂર્ટ માટે શરાખની આવશ્યકતા રહે જ નહિ. સારી તંહુરસ્તી અને પૂરતા

પ્રમાણુની જીવનશક્તિ જ શારીરિક અને માનસિક જીવંતતા બદ્ધ છે અને નહિ કે શરાગ.

### ખેલાડી જેવી ચયળતા માટે ઓરાક

ખેલાડીનો જેમ યૌવનસુલલ ચયળતા અને સ્કૂર્ટિઝપી ધનનો સો અથવા તેનાથી વધારે વરસો સુધી ઉપયોગ-ઉપલોગ કરવા માટે સંચર્યકુ કરવો જેઈએ, તેની કીમત આર્થિક સંપત્તિથી ઓછી ન આંકવી જેઈએ. આ પ્રકારનું યૌવનસુલલ અને સ્કૂર્ટિમય વિશિષ્ટ જીવન પ્રાપ્ત કરીને તેને લોગવવામાં ઓરાકનું સ્થાન મહત્વનું છે. જે માણુસું કુદરતી રીતે જીવન પસાર કરે છે, તેના માટે જીવન એક આનંદમય અનુભવ અને સંધર્ષ છે. પરંતુ અકુદરતી જીવન પસાર કરનાર માટે તે હુઃખ્યપૂર્ણ રૈન્જિંદો કાર્યક્રમ છે. આવા લોકો હુંમેશાં થાકેલા જ હોય છે.

ઓરાક મારકૃત મળેલાં તત્વોથી શરીરના કોષોને પોષણ મળે છે. શરીરના પ્રત્યેક અવયવમાં જે જીવન-રસનો સંચાર થાય છે તેના મૂળમાં ઓરાક જ છે. કોઈ-કોઈ વેળા એવો પણ સમય આવે છે કે જ્યારે આપણું મન ગમે તેવી સમસ્યાનો તરત જ ઉકેલ લાવે છે અને કોઈ કોઈ વેળા સાવ સહેલી સમસ્યાનો ઉકેલ લાવવાનું પણ મુશ્કેલ થઈ પડે છે. આ બન્ને પ્રકારના સંયોગોની ઉત્પત્તિમાં આપણું ઓરાકની ટેવો અસરકારક ભાગ લજવે છે. માનસિક નિર્ભળતા, થકાવટ, નિરાશા, વધારે પડતો

આશાવાદ અને નીચલા સ્થળની માનસિક દર્શાની ઉત્પત્તિમાં આપણો તત્ત્વહૃદીન ખોરાક આગળ પડતો લાગ જઈવે છે. આ બધા ગુણો ખેલાડીની યૌવનસુલલ સ્કૂર્ટિંના નથી. આનંદ અને સ્કૂર્ટિં માટે કુદરતી અને પોષક ખોરાકની જ આવશ્યકતા નથી. સમતોલ આડારની પણ આવશ્યકતા છે.

### ચોખખા લોહીનું પરિભ્રમણુ

મેં જ્યારથી કુદરતી જીવન જીવવાની પદ્ધતિને અનુસરવાનું શરૂ કર્યું છે, ત્યારથી મારા મગજ અને જાયની મનમાં કેટલાય ફેરફાર થયા છે. આ પદ્ધતિને અનુસરવાથી મારામાં એક એવી શક્તિનો પ્રાદુર્ભાવ થયો છે જેનો સ્પર્શ કેટલાક પાશ્વાત્ય દેશોના લોકોને થયો છે. આ શક્તિ માટે હું ગૌરવશીલ પણ છું. હું આ પ્રક્રિયાનો જવાબ શોધું છું—સમય વિશ્વની ચેતના સાથે મારા મનનો સંપર્ક સ્થાપી શકાય અરો? જે સમયે મારા મનમાં આ પ્રક્રિયાની ઉપસ્થિત થાય છે, તે સમયે હું એકાંતમાં મનન-ચિંતન કરું છું અને ધ્યાન ધરું છું. આ પ્રક્રિયાના ગાળા દરમિયાન જ મારા ધારેલા પ્રક્રિયાનો જવાણ મેળવી લડું છું. ભારતના યોગીઓ જેવી સર્વોચ્ચ માનસિક શક્તિ પ્રાપ્ત કરવા માટે શુદ્ધ લોહીનું પરિભ્રમણુ, ઉપવાસ, જીવનપોષક ખોરાક, ડાંડા શાસોચ્છ્વાસ અને ચેતનાદાયી ખોરાકની જરૂરત છે.

મનુષ્ય ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. માણુસે માનસિક

શક્તિના જેરે એવી શોધો કરી છે કે જેની આપણે પોણુસે વરસ પહેલાં કદમ્પના પણ ન કરી હોય. જે તે સમયે કોઈ માણસે કલ્યાં હોત કે આપણે અવાજ કરતાં પણ વધારે ગતિથી મુસાફરી કરી શકીએ છીએ, તમે વોશિંગટનમાં ભાષણું આપો તે એ જ વખતે આખી હુનિયામાં સાંસળી શકાય છે, તમારા એરડામાં બનેલા કોઈ પણ પ્રસંગને ટેલિવિઝન મારકૃત ચિત્રસ્વરૂપે જોઈ શકાય છે, તો તેને પાગવ ગણી કાઢવામાં આવ્યો હોત. પરંતુ આ એક વાસ્તવિક સત્ય છે કે માણસે આ બધી ચમત્કારી શોધો તેની માનસિક શક્તિ વડે જ કરી છે.

સામાન્ય માણસ શારીરિક અને માનસિક નિર્ભળતાને અનુભવ કરતો હોય છે. તે નિર્ઝવ એરાક લે છે. તે કુદરતી જીવનનું મહત્વ સમજતો નથી. આ કારણને લીધે તેની શક્તિ ધીરે ધીરે હુણાઈ જાય છે. શરૂઆતમાં તે નાનીનાની માંહગીઓનો લોગ થઈ પડે છે અને છેવટે નિર્ઝળ થઈ જાય છે. આ લોકોને થાય છે કે તેમણે જીવન પસાર કરી હીધું....હવે આપણે અંતકાળ છે.

જે માણસે કુદરતી જીવન અને તેના નિયમોનું જ્ઞાન મેળવી લીધું છે અને જેણે આ કુદરતી નિયમોને સાનુકૂળ જીવન કેળવ્યું છે, તેને તેટલો જ શારીરિક અને માનસિક શક્તિ મળી રહે છે. આપણે જેટલો સમય કુદરતી જીવન જીવીએ છીએ એટલું જ આપણને જીવનનું

જ્ઞાન અને અનુભવ મળે છે. શુદ્ધ લોહીનું પરિભ્રમણ અને શારીરિક પોષણ યુદ્ધને સંબંધ અને તીવ્ર અનાવે છે. તેનાથી મન અને મગજ સંવિશેષ સંવેહનશીલ થાય છે. લોહીની શુદ્ધિ પર જ ત્વરિત નિર્ણયશક્તિનો આધાર છે. કામગારા મગજના કોષેને ચોખણું લોહી જ પોષણ આપે છે. લોહી જેટલું ચોખણું હશે, તેટલું જ મન અને મગજ સંબંધ અને અહૃણુશીલ હશે.



જીવવા માટે ભોજન છે, ભોજન માટે જીવન નથી.





[ ૭ ]

## હું ભારતીય સંતો પાસેથી શું શીખ્યો ?

મેં લાગવાગટ કેટલાંચ વરસ સુધી ભારતની મુસાફરી કરી અને ત્યાંના મહાન સંતોને મળ્યો. તેમનાં ચરણ-કમળમાં બેઠો અને તેમની પાસેથી જ્ઞાન મેળવ્યું. આ સંતો શીખબોધની વિશિષ્ટ શક્તિ કેવી રીતે મેળવે છે ? હું તેમની પાસેથી શીખ્યો કે તેમણે આ જ્ઞાન સત્ત્વહૃતી ઘોરાક, કડવી ચા કે કોકી, ધૂમ્રપાન, મદ્યપાન અને શારીરિક આણસ કેળવીને મેળવ્યું નહોતું. તેમણે આ જ્ઞાન કુદરતી ઘોરાક અને ચોગના અલ્યાસ મારફત મેળવ્યું હતું. માનસિક અને શારીરિક વિકાસનો સારામાં સારો રસ્તો ચોગાલ્યાસનો છે. મેં ભારતીય સંતો પાસેથી શારીરિક અને માનસિક તંહુરસ્તી વિશે ધારું ધારું શિક્ષણ લીધું છે. ભારતમાં એવા સંતો હતા જેમનું આચુષ્ય સો વરસ કરતાં વધારે હતું. તેમનાં શરીર મૂર્તિમંત શક્તિની જેમ સુંદર હતાં. તેમની બુદ્ધિ એટલી બધી સન્નગ અને તીવ્ર હતી કે તે બીજના વિચારો જાણું લઈને કહી શકતા હતા. આજે પણ તેમના અગાધ જ્ઞાનની શક્તિના પ્રમાણમાં પાશ્ચાત્ય દેશોના જાણુકારો ધણા પાછળ છે.

તેમની ખાસે સુંદર ખડતલ શરીર અને મન જ નહોતાં, પરંતુ આધ્યાત્મિક શક્તિ પણ હતી. આ આધ્યાત્મિક શક્તિથી પાત્રાત્મક હુનિયાના લોકો અજણ હતા.

માણસ પ્રયત્ન કરે તો આ કીમતી તથ્યોને કુદરતી લુધન પસાર કરીને જરૂર મેળવી શકે. ભારતમાં મારે એક સંત સાથે મુલાકાત થઈ હતી. તેમનું આચુષ્ય એકસોને એકત્રીસ વરસનું હતું. તે કેટલીય લાખાઓના જણકાર હતા. આટલી ઉંમરે પણ તે તરવા-દોહવાની કસરત કરતા હતા. તેમના શરીર પર કરચલીઓનું નામનિશાન નહોતું. કુદરતના નિયમોનું પાલન કરવાનું આધનામ હતું. કુદરતના નિયમોનું પાલન કરીને તમે સારી તંહુસ્તી અને કુશાચ ઝુદ્ધ પ્રાપ્ત કરી શકો છો એટલું જ નહિ, પરંતુ સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક શક્તિ પણ પ્રાપ્ત કરી શકો છો.

### આધ્ય અને પેય પહાર્યો

શક્તિ, સારી તંહુસ્તી, માનસિક સંબંધતા, બૌદ્ધિક અહૃણુશક્તિ અને સ્ક્રૂતિમય ચુવાવસ્થા—આ બધાનો આધાર તમારા ઓરાકના પ્રમાણ પર નથી, પરંતુ તેના પચવા અને લોહીમાં લગવા પર છે. યાદ રાખો કે શક્તિ બહારનો ઓરાક લેવાનો અર્થ થાય છે માનવીય શક્તિનો હુદુપચોગ. પાચનકિયા લાગલાગાટ ચાલનારી કિયા છે. ઓરાક પચીને ત્રીસ કૂટ લાંબાં આંતરડાંભાંથી બહાર નીકળી જવો જોઈએ. વધારે ઓરાક લેવાથી પાચન અંગોને વધારે કાર્ય કરવું

પડે છે. આ વધારાના શ્રમથી આ અંગો થાકી જય છે. તેમની શક્તિનો હ્લાસ થાય છે. તેનાથી આયુષ્યમર્યાદા પણ ઓછી થાય છે.

લગભગ સરળી ઉંમરના કેટલાક માણુસોના કાર્યો અને તેની પદ્ધતિ પરથી તેની અસર જણી શકાય છે. કેટલાક લોકો કસમથે જ વિચારવા લાગે છે કે મારું અહિં આયુષ્ય તો પૂરું થઈ ગયું છે અને આ કારણને લીધે જ મારું શરીર નણળું પડી ગયું છે. મને અશક્તિ પણ વરતાય છે. આ ઉંમરે મારું શરીર નણળું પડે અને અશક્તિ વરતાય તે સ્વાસ્થાવિક છે....આ રીતે કેટલાક લોકોની તકલીફો કાં તો અધવચ્ચ ઉંમરે શરૂ થાય છે કે વધી જય છે. પરંતુ કેટલાક માણુસો એવા હોય છે કે જેઓ તેમના મનમાં નિરાશાજનક વિચારોને ડાંડિયું કરવા હેતા નથા. અહિં આયુષ્ય પૂરું કર્યા પછી પણ તેઓ સ્કૂર્ટિભય મન અને શરીરના લોક્તા (માલિક) હોય છે. આ લોકો તેમની ધગશને વૃદ્ધાવસ્થા સુધી એંચી જય છે. હું જાણું છું કે આવા લોકોના જીવનના ઉલ્લાસ અને ઉમંગને ખસો વરસ સુધી પણ એંચી જઈ શકાય છે.

માંસપેશીઓની સંજગતા અને જીવનોલ્લાસની જીવંતતાનું ઘડતર આપણી સહા જયતાવસ્થા કરે છે. જે શરીર જરૂરત કરતાં વધારે વિકારયુક્ત ઝોરાક લેશો, તેટલા જ વધારે પ્રમાણમાં તેના શરીરમાંથી ખટાશ અને ઊર

ખડાર નીકળશે અને તેનાથી સનાયુતંત્ર શિથિત થશે. સનાયુતંત્રની શક્તિનો સુધ્ય પ્રવાહ અન્ય શક્તિઓની જેમ એરાક જ છે. પરંતુ વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે સનાયુચો અને મગજના સંચાલન માટે થોડા જ એરાકની જરૂરત છે. એરાક લીધા પછી તરત જ મગજ અને સનાયુચોમાં શક્તિનો સંચાર થતો નથી. પરંતુ જ્યારે એરાક પચી જય છે કે ઉપવાસ કરવામાં આવે છે, ત્યારે જ શક્તિ આવે છે. સનાયુચો વધારે પડતા એરાકથી ઝૂટચા પછી પણ (ઉપવાસ દરમિયાન) શરીરમાં એકઠાં થયેલાં પૌષ્ટિક તત્ત્વોમાંથી શક્તિ મેળવી લે છે.

માણુસના જીવનનું નિયંત્રણ ત્રણ નિયમો કરે છે— પોષણ, ગતિ અને પ્રાણુવાયુ. આ ત્રણેય નિયમોનું મધ્યબિંદુ છે એરાક. એરાકની ચારે બાજુએ આ નિયમો પરિભ્રમણ કરે છે. સજીવ, પોષણુક્ષમ અને ખનીજ અને પૌષ્ટિક તત્ત્વોવાળો એરાક શરીરમાં પરિવર્તન લાવે છે, વજનમાં વધારે કરે છે અને શક્તિનો સંચાર કરે છે. વધેલી શક્તિનો ઉપયોગ વ્યાયામ મારફત કરવામાં આવે તો ઊંડા ચ્યાસોચ્છ્વાસ લઈ શકાય. આ રીતે એરાક મારફત જીવનના ત્રણ નિયમો પાળી શકાય છે.

એરાકનું સારું પરિણામ મેળવવા માટે આપણે એવા એરાકની પસંદગી કરવી જોઈએ કે જે શરીરને જરૂરી શક્તિ અને પોષણ આપે. પોષણુનો પહેલો સિદ્ધાંત કે યગથિયું આ જ છે. આપણે આ સિદ્ધાંતનું જેટલી સારી

રીતે પાલન કરીશું, તેટલા જ પ્રમાણુમાં આપણા મન અને શરીરનો વિકાસ થશે.

તમારે તમારા જમવાની શરૂઆત ઝેણો અને કાચાં શાકભાળુના સલાડથી કરવી જોઈએ. તમે જેટલા પ્રમાણુમાં કાચાં ઝેણ અને શાકભાળું ખાઈ શકો, તેટલા પ્રમાણુમાં ખાઓ. કાચો ખોરાક જ માણુસનો સાચો ખોરાક છે. જ્યાં સુધી તમે સારી રીતે કાચો ખોરાક ન લો, ત્યાં સુધી રાંધેલો ખોરાક ન લેશો. શાકભાળુનું સલાડ અને ઝેણો લીધા પછી તમારે ઉકાળેલાં શાકભાળું લેવાં. ત્યાર બાદ તમે સ્વર્યમુખીનાં બીજ, ગર (અંદરનો માવે!), તલ અને અનાજની બનાવેલી ણીણું વસ્તુએં લો. આ નિર્દેષ ખોરાક છે. ત્યાર બાદ વાલોર, મસૂર, વટાણું, ચોખા અને માખણું જેવી પ્રોટીનવાળી વસ્તુએં લેવી.

ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે તમારે ઉંમર કે કાર્ય પ્રમાણે તેનું વગીંકરણ કરવું જોઈએ. એટલું તો સ્પષ્ટ જ છે કે ઉંમરલાયક થતા ખાળક કે ચુવાન માટે ઘઉં, ચોખા અને જવ જેવા ખોરાકની આવશ્યકતા છે. આ ખોરાક હાડકાં, હાંત અને કોમળ હાડકાં (અં. કાર્ટીલેજ)ને વધારે છે. જે માણુસો પરિપક્વ ઉંમરે પહોંચી ગયા છે, તેમણે તેમનું શરીર થોડાક પ્રમાણુમાં આ ખોરાક લઈને સુધારવું જોઈએ.

ખોરાકનું પ્રમાણ ઘટાડયા પછી તમારું વજન, તમારી શક્તિ અને તમારી સ્ક્રૂટિંગમાં કોઈ ફેરફાર થયો

છે કે કેમ તે તમારે જાણી લેવું જોઈએ. ઓરાકની પસંદગી કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે આ ઓરાકમાં જરૂરી પોષક તત્ત્વો, જીવનતત્ત્વો અને અનીજ તત્ત્વો પૂરતા પ્રમાણમાં છે કે નહિ. ખીજ શાહેમાં કહીએ તો, તમારે ઓરાક જીવંત અને કુદરતી હોવો જોઈએ. આ ઓરાક લેતા હો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારું વજન બરાબર છે કે કેમ. જે તમારું વજન ઓછું હોય તો સામાન્ય વજન મેળવવા માટે તમારે વધારે ઓરાક લેવો પડશો, જે તમારું વજન વધારે હોય તો તમારે ઓછા ઓરાક લેવો પડશો. જે તમે આ સલાહનો અમલ કરશો, તો શરીરને ખાસ તકલીફ આપ્યા વિના જ તે સ્કૂર્ટિમંત બનશો અને તમે ચુવાવસ્થાનો અનુભવ લઈ શકશો.

ગંલીર માંદગીમાં પટકાઈને પથારીવશ ન થાય ત્યાં સુધી ખાઉધરાં માણુસો પોતાની જતને સન્ન-સારા હોવાનો હાચો કરે છે. ગંલીર માંદગી ન હોય ત્યાં સુધી આવા લોકો પોતાના શરીરને તંહુરસ્ત માની કે છે. શારીરિક ચૈતન્ય, સ્કૂર્ટિ, આનંદ અને માનસિક સ્વસ્થતા-આ છે જીવનના સ્વાભાવિક ગુણો. આ ખાઉધરાં માણુસો મારી સલાહ માનશો, તો તેમની તણિયત બગાડચા વિના તે લાંખું આચુષ્ય ભોગવી શકશો.



જરાનિ જળદતાં આવડયો તેને જીવતાં આવડયું.





[ ૮ ]

## ઓરાકની પસંદગી

આપણે આપણા ઓરાકની પસંદગી ઋતુ પ્રમાણે કરવી જોઈએ. ગરમી અને શક્તિ પરસ્પર સંકળાયેલાં છે. શિયાળામાં વધારે તાપ (ગરમી) અને / કે વધારે કેલરીવાળો ઓરાક લેવો જોઈએ. બીજા શાખામાં આપણે એમ કહી શકીએ કે ઉનાળામાં ગરમ પદાર્થને ઉપયોગ ન કરવો જોઈએ કે ઓછો કરવો જોઈએ. કારણ સ્પષ્ટ જ છે—અંહરની ગરમી અને બહુરની ગરમીના સંયોગથી રોગ ઉત્પન્ન થાય છે.

કાર્યશીલતા અને શક્તિમાં વધારો કરવા માટે ઓરાકની જરૂરત છે. ઓરાકની પસંદગી આપણા કામ-ધંધા પ્રમાણે કરવી જોઈએ. ઓરાક અને કામની જેટલી સારી સમતુલ્ય જળવાશે, તેટલા જ તમે હીધ્યાયુધી, સશક્ત અને તંહુરસ્ત રહેશો.

હરકોઈ જીવધારીના જીવનનો આધાર ગતિશીલતા કે કાર્યશીલતા પર જ હોય છે. આપણા શરીરમાં છસો

જેટલી માંસપેશીઓ છે. આ માંસપેશીઓનો હંમેશાં ઉપયોગ કરવો જેઈએ. જે તમે આ માંસપેશીઓનો ઉપયોગ નહિ કરો, તો તમારે તેનાથી (કાર્યશીલતાથી) હાથ જ ધોઈ નાખવા પડશો ! કાર્યશીલતા અથવા વ્યાયામ થાક લાગે ત્યાં સુધી સર્જનાત્મક છે. આ મર્યાદા વરાવ્યા પછી આ જ વ્યાયામ ખંડનાત્મક-વિનાશાત્મક ગુણ ધારણું કરે છે. સરખી જમીન પર ધીરે ધીરે ચાલવું, સવારે ઝરવા જવું, તરવું અને સાઈકલ ચલાવવી—આ બધી ફાયદાકારક કસરતો છે.

### સંપૂર્ણ શક્તિ માટે કાર્યશીલતાના સિદ્ધાંતનું પાલન કરો।

વ્યાયામ નિયમિત અને નિયમસર કરવામાં આવે તો તેની અસર આખા શરીર પર થાય છે. વ્યાયામ મારફત સારામાં સારી તંહુરસ્તી, પ્રશસ્ત્ય માનસિક શક્તિ અને હીરધ્યુષી જીવન પ્રાપ્ત કરી શકાય છે.

પ્રાચીન કાળથી વ્યાયામનો ઉપયોગ માંસપેશીઓ અને સ્નાયુઓનો શક્તિ વધારવામાં થાય છે. ભારત પ્રાચીન કાળથી ‘યોગવિધા’ના શુરુ તરીકે ઘ્યાતનામ છે. વ્યાયામનો ઉપયોગ શારીરિક અભ્યવસ્થા અને રોગોને ફર હૃટાવવા માટે થાય છે. શ્રીકવાસીએ તંહુરસ્ત, સશક્તા, લાંબું અને સુંદર જીવન જીવતા હતા. તેનું રહસ્ય એટલું જ છે કે આ લોકો નિદ્રા અને જોરાકની જેમ સમયસર નિયમિત વ્યાયામ કરતા હતા.

સ્વાર્થ્ય વિલાગના સત્તાધીશો અને જાણકારો એવું  
કહેતા સંભળાય છે કે આપણી હુનિયાની સંપૂર્ણ આખાહી  
વર્તમાન ચુગની પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરવામાં શારીરિક  
રીતે અશક્તા, કોમળ અને અચોજ્ય થતી જય છે. આનું  
સુખ કારણું શરીરનાં જુહાં જુહાં તરોમાં સમતુલા જાળવતી  
વ્યાયામની ઓછાપ છે.

આજના જમાનામાં શહેરી જીવન જાંધિયાર, ગતિ  
વિનાનું અને અદુહરતી બનતું જય છે. શરીરનું હુલનચલન,  
કારખાનાનો શોરખકોર, જીવનની ભુનિયાહી આવશ્યકતાએ  
અને સામાજિક તેમજ વ્યક્તિગત સંઘર્ષ, અકસ્માત,  
ગિરહી, કુમાડો અને એંચતાણું (તનાવ)-આ બધાં સ્નાયુ-  
તંત્રને ઉશ્કેરીને તેને થકવી હે છે. મહિનાએ અને વરસો  
સુધી આ એંચાણુને લીધે ઉદ્ભબતા થાકની શરીર પર  
કાયમી અસર પડે છે. નવા સંચોગોનો સામનો કરવાની  
અને જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની આપણી શક્તિ  
ધીરે ધીરે ઘસાતી જય છે.

### કેન્દ્રીય સ્નાયુતંત્ર પર વ્યાયામની અસર

આ બધી કસરતોની સ્નાયુતંત્ર પર ખૂબ જ સુંદર  
અસર થાય છે. વ્યાયામથી સૌથી મોટો ઝાયહો એ  
થાય છે કે વેગીલો રક્તપ્રવાહ, શ્વાસોચ્છ્વાસ, પાયન અને  
કુદરતી મળચાગની કિયાથી સ્નાયુતંત્ર સંજગ થાય છે!  
સ્નાયુતંત્રના કોષેનું ઘડતર કોષાણુએ જ કરે છે. આ  
કોષોને જીવવા માટે ચોજ્ય આહાર અને પોષણુની જરૂરત

હાય છે. વ્યાયામ કોષાળુઓમાં લોહીને વહેતું કરીને જીવંત વિષને હૂર કરવામાં શરીરને મહદ કરે છે! શરીરમાં વિકૃત સ્વરૂપે જે જીવંત વિષ અટકી જાય છે, તે હીર્ધાયુધ્યનો સૌથી મોટો શક્તિશાળી હુશ્મન છે.

આપણે બધા ઐલાડીઓની ચ્યપળતા અને હોશિયારીના વખાળું કરીએ છીએ. કિકેટનો ઐલાડી જેરથી હોડો ફેંકે છે, તે જોઈને આપણને નવાઈ લાગે છે. ટેનિસના ઐલાડીની રમત જોઈને આપણે દંગ થઈ જઈ એ છીએ. આ યોગ્યતા માંસપેશીએ. અને સનાયુઓના સમન્વયથી ઉદ્ભવતી શક્તિનું પરિણામ છે.

વ્યાયામ એંચ અને થકાવટને હૂર કરે છે. મગજને પ્રકુલ્પિત કરે છે. તે થાકેલા અને તનાવવાળા સનાયુમંઢળને આરામ આપે છે. તેનાથી મગજનું ધ્યાન નવી જ હિશામાં કેન્દ્રિત થાય છે. તેની અસર કેવળ માનસિક સ્થિતિ પર જ પડતી નથી, પરંતુ શારીરિક સ્થિતિ પર પણ પડે છે. વ્યાયામ મન અને શરીર બંનેમાં સ્કૂર્ટિં લાવે છે. બંને ચેતનવંત બને છે. તંહુરસ્તીના નિયમોમાં આરામ અને વ્યાયામ બંને પર ધ્યાન આપવું જોઈ એ.

વ્યાયામ કરવાથી ગાઢ નિદ્રા આવે છે. તેનાથી સનાયુઓ અને કોશોનું ઘડતર થાય છે. સવારે વહેલા ઊઠવાને લીધે શરીરમાં નવી જ શક્તિનો સંચાર થાય છે. આખા દિવસનાં કાર્યોની શરૂઆત કરવા માટે તે ઉમંગલેર તૈયાર થાય છે. વ્યાયામ સનાયુતંત્રની અભ્ય-

વस्था, નિર્ભળતા અને મગજના ગેર-સંચોજનને હુરે  
કરવામાં મહત્વનો લાગ ભર્યે છે. આ સંચોગોમાં  
સુધારો કરવા માટે માણસના વાતાવરણ અને ટેવોમાં  
ફેરફારો કરવાની આવશ્યકતા છે. જુહી જુહી જાતની કસરતો  
માનસિક સ્થિતિ અને સનાયુતંત્રને જાયત કરવામાં અગત્યનો  
શાળો આપે છે. આ કારણને લીધે તમારે આજે જ એક  
એવી ચોજના ઘડી કાઢવી જોઈએ કે જેમાં તમારે એ  
માઈક જેટલું જડપથી દોડવાનું અને થાડીક કસરતો  
કરવાની હોય.

### પ્રાણુવાચુ

શાસોચ્છ્વાસ દરમિયાન આપણે પોષક-પ્રાણુદ્ધાર્યી  
વાચુ અંદર જેંચીએ અને હૃષિત કાર્બન ડાયોક્સાઇડ  
વાચુ બહાર કાઢોએ છીએ. કાર્બનનું આ કુદરતી ચક  
આશ્ર્યોપ્રદ સંભિશણુનો અદ્ભુત નમૂનો છે. આપણે પાછો  
ઠેલેદો કાર્બન ડાયોક્સાઇડ વાચુ વનસ્પતિજગત ચહુણુ  
કરે છે અને બહલામાં પ્રાણુદ્ધાર્યી વાચુ છોડે છે. શહેર  
છોડીને ગામડાંમાં જવાની તક મળો ત્યારે આપણે  
વધારેમાં વધારે સમય અડવાની પાસે જ વિતાવવો  
જોઈએ ! જે લોકો તંહુરસ્તીપૂર્ણ લાંબું જીવન પસાર  
કરે છે, તે વૃક્ષો, ઝૂલ્યો અને વેલાઓની પાસે જ રહેતા  
હોય છે.

### ગાંડા શાસોચ્છ્વાસનું મહત્વ

આપણે જ્યારે આ હુનિયામાં પ્રવેશ કરીએ છીએ

ત્યારે સૌથી પહેલું કામ શાસોચ્છ્વાસ લેવાનું કરીએ  
છીએ અને આપણા છેલ્લા શાસોચ્છ્વાસનો એવો અર્થ  
થાય છે કે આપણું આ હુનિયામાં રહેવાનું કાર્ય પૂરું  
થઈ ગયું છે. એટલા માટે ડાંડા શાસોચ્છ્વાસ લો.  
પળેપળે આપણું ધ્યાન ડાંડા શાસોચ્છ્વાસ લેવા પર  
કેન્દ્રિત થવું જોઈએ. આપણાં ફેઝસાંમાં વધારેમાં વધારે  
હવા ભરાવી જોઈએ. ડાંડા શાસોચ્છ્વાસ લેવાની કિયાને  
તમારા સ્વભાવમાં જ વણી લેવી જોઈએ. હું ઈચ્છું છું  
કે તમે કિયાશીલ વ્યક્તિ બનો. આ કારણને લીધે જ હું  
વારંવાર આ શર્ષણો પર ભાર મૂકું છું. આપણે દોડીએ  
છીએ, ઝડપથી ચાલીએ છીએ કે નિસરણી ચડીએ છીએ,  
ત્યારે ડાંડા શાસ લઈએ છીએ અને આપણા શરીરને  
વધારે કિયાશીલ બનાવીએ છીએ.

રમતવીર અને સંગીતકારનાં ફેઝસાં સારાં હોવાં  
જોઈએ. તેમની સફળતાનું સુખ્ય તત્ત્વ છે વાયુ અને  
જીવનશક્તિ. સામાન્ય માણુસ આ હકીકતનો સ્વીકાર  
કરતાં અચકાય છે કે ફેઝસાંના નિયમિત અને સક્રિય  
ઉપયોગથી તે આખી જિંદગીમાં કેટલી વધારે જીવન-  
શક્તિ, હીર્ઘાયુષ્ય અને આનંદ મેળવી શકે છે. ડાંડા અને  
લાંબા શાસ લેવા જ જોઈએ.

હસમુખા સ્વભાવનો માણુસ હંમેશાં સુખી રહે છે.  
હાસ્ય ફેઝસાં અને પેટને સારામાં સારી કસરત કરાવે છે.  
હાસ્ય કુદરતી અને ઉલ્લાસમય હોવું જોઈએ. જે લોકોને

હસવાની ટેવ હોય, તેમની સાથે રહેણ અને હાસ્યમાં સહકાર આપો ! ટેલિવિજન અને ચિનેમામાં પણ તમારે ખડખડાટ હસાવે તેવાં ચિત્ર જેવાં જોઈએ. હાસ્યરસના પુસ્તકો વાંચવાનું તમારે વ્યસન પાડવું જોઈએ !

તમે જેટલા વધારે હસશો, તેટલી જ તમારી તખ્ખિત વધારે સારી રહેશો.




આનંદ જીવનનું સર્વોત્તમ રસાયન છે.



[ ૮ ]

## જવનનું વાર્તાવિક તત્ત્વ : શુદ્ધ વાયુ



સંપૂર્ણ વૃદ્ધિ અને સંપૂર્ણ વિકાસની ટોચ પર પહોંચવા માટે આપણું શુદ્ધ વાયુને ખ્યાલ કરી શકતા વાયુ (અં. ઓક્સિજન) લોહીને સ્વચ્છ અને વિકાર રહ્યા હનારે છે અને શરીરના કોણોને શુદ્ધ લોહીને પુરવઠો પૂરો પાડીને તેમનામાં સ્કૂર્ટિં અને શક્તિનો સંચાર કરે છે. તમે જ્યારે પ્રાણદાતા વાયુ લો છો, ત્યારે તમારું રુધિરાલિસરણું પણ ચેતનમય બની જાય છે. આ રીતે શુદ્ધ વાયુ મારક્ષત તમારા કોણાણુંઓથી માંડીને શરીરના અંગોએ ગમાં રહેતા વિકારને તમે સહેલાઈથી બહાર ફેંકી શકો છો.

પ્રસિદ્ધ સંગીતકારીનાં નામો યાદ કરશો તો તમને જાણીને આશ્ર્ય થશે કે તે કોણો કેટલા હીર્ઘાયુષી હતા. સંગીતકારો પાસેથી આપણે ઊંડા શ્વાસ લેવાનું શીખવું જોઈએ. માનવશરીરને ઊંડા શ્વાસ લેવાથી અને શુદ્ધ અને નવધડતર કરનારા પ્રયોગોથી (વાળના મૂળથી અંગૂહાના નખ સુધી) સંભગ અને ડિયાશીલ રાખી શકાય છે. તેનાથી અંગોએ ગમાં સ્કૂર્ટિંનો નવસંચાર થાય છે. આ કારણને લાધે તમારે હંમેશાં કસરત કરવાનો અને ઊંડા શ્વાસોચ્છ્વાસ લેવાનો મહાવરો રાખવો જોઈએ.

## શતાચુ થવા માટે જીવનની કલા શીખો

જીવનનું અસ્તિત્વ પોષણ, ગતિ અને પ્રાણવાચુ આંગણ સિદ્ધાંતોના પાયા પર આધારિત છે. જે જીવનઘડતરના તત્ત્વ (ઝોરાક)ની પસંદગી કુદરતી રીતે કરવામાં આવે, તો સહજપણે લાંબું જીવન પસાર કરી શકાય છે. આથી જીલટું, આ સિદ્ધાંતોની આપણે જેટલા પ્રમાણમાં અવગણુના કરીશું, તેટલા જ પ્રમાણમાં આપણો આવરણ એહો થશે અને આપણો આરોગ્યને નુકસાન કરીશું. આપણા રોગો કુચારેય હૂર નહિ થાય.

સભ્ય કહેવાતા લોકો પણ જ્યાં સુધી ઝોટી આણું-પીણું અને અકુદરતી સંચોગો વચ્ચે જીવન પસાર કરે છે, ત્યારે તેમને શારીરિક હુઃખો લોગવવાં પડે છે. જે પ્રમાણમાં ઝોટી આણું-પીણુંથી હુઃખ અને શારીરિક તકલીફોમાં વધારો થાય છે, તે જ પ્રમાણમાં સારી આણું-પીણુંનું જીવનમાં મહત્વ છે.

આજના જમાનામાં વૈજ્ઞાનિક દસ્તિકોણથી માંદગીનો કોઈ ધીલાજ જ નથી. કુદરતે માણસને રોગોની દેણુંની કરી જ નથી. આ કારણને લીધે કુદરતે ધીલાજની કોઈ વ્યવસ્થા પણ કરી નથી. આધુનિક વિજ્ઞાનની નજરે ધીલાજ (સારવાર)નો અર્થ થાય છે રોગનાં કારણોનો નાશ કરવો. અને કુદરતી રીતે તંહુરસ્તી પ્રાપ્ત કરવી. બધા આહાર-શાસ્કીઓએ અકુદરતી ઝોરાકના સેવનને રોકવાના પ્રયત્નો કરવા જોઈએ. કુદરતને તેનું ડેલણિયું (કુદરની ઝોરાક)

આપો જેથી તે તેનું કાર્ય કરી શકશે. આ બન્ને નિયમોનું જ્યારે ઘેરઘેર પાલન થશે, ત્યારે કુદરત રોગોની એવી રીતે સારવાર શરૂ કરશે જેવી રીતે તેણે આ રોગોને જરૂર આપ્યો.

કુદરતી નિયમોના ઉદ્વાંધનનું પરિણામ છે રોગ. સામાન્ય રીતે મીણુખતીને બન્ને છેઠેથી સળગાવવાનો પ્રયત્ન થાય છે. મીણુખતીને બન્ને છેડે સળગાવવાની કેટલીય રીતો હું તમને જણાવી શકું છું. આ પ્રમાણે કરવાથી જીવનશક્તિનો હાસ થાય છે.... જીવનશક્તિ હુણાઈ જાય છે. પરંતુ મેં જે રસ્તો બતાવ્યો છે, તે સાચો છે. તમારે મીણુખતીને એક જ છેઠેથી સળગાવવી જોઈએ.

જીવનશક્તિને નિર્ભળ બનાવતાં કેટલાંક કારણો આ પ્રમાણે છે :

- (૧) બધા જ પ્રકારનો અતિરેક,
- (૨) ભરેલા અને જીવનશક્તિ વિનાના ઓરાકનો ઉપયોગ,
- (૩) શરાબ પીવો અને ચા, કોકી અને ઠંડા પદાર્થોનો વપરાશ,
- (૪) ભારે પાણુનો ઉપયોગ,
- (૫) મોઠાનો વધારે પડતો ઉપયોગ,
- (૬) ઉતાવળા કોળિયા ભરીને ખાવું,
- (૭) ચિંતા કરીને સનાયુઝોની શક્તિને તાવવી,
- (૮) સૂર્યના પ્રકાશથી વંચિત રહેવું,
- (૯) ધણી જ એછી જાંધ લેવી,
- (૧૦) કસરતના અલાવે હૃદય અને નાજુક અવયવો પર દખાણ લાવવું,
- (૧૧) છીછરા શાસોન્ધૂવાસ,
- (૧૨) શુષ્ણ.

પ્રાણુવાયુનો અભાવ, (૧૩) અનિયમિત શારીરિક ટેવો અને (૧૪) વધારે પડતી મહેનત.

અકુહરતી કે અસ્વાભાવિક ઓરાકનો અર્થ થાય છે— શારીરિક શક્તિ કરતાં વધારે શક્તિ વાપરવી જેથી આવકળવક સરખર ન રહે. આપણી ઉંમર પાસેથી આપણે એવો ‘એક’ વટાવીએ છીએ કે જેમાં ‘ઐલેન્સ’ કરતાં વધારે રકમ વપરાતી હોય છે અને છેવટે ખાતાની રકમ ખલાસ થઈ જાય છે. મછી તો ઉમરની એકમાંથી તમારું નામ જ ભૂસી નાખવામાં આવે છે (અર્થાત् તમારું મોત થાય છે) !

### શારીરિક ફેરફારને ઉંમર ગ્રમાણે વિરુદ્ધ દિશામાં હોઈ જવો

ઉંમરે વૃદ્ધ હેખાવું એ કેવળ ખરાળ સંઘેગો સાથેના શારીરિક સુમેળની અસર છે. તે ધિશારો કરે છે કે કુટેવો અને શરીર વચ્ચે મૈત્રા બાંધાઈ ગઈ છે. લાંખા આચુષ્ય માટે સારા સંઘેગોને આવકારો, શરીરને નિર્ણય અનાવતી પ્રવૃત્તિએને થાંભાવી હો. અને નવઘડતરમાં મન પરોવી હો. શરીર પર ઉંમરની અસર પડવા દેશો નહિ. જે કારણુને લીધે શરીરનો નાશ થાય છે, તે જ કારણુને લીધે શરીર વૃદ્ધ પણ થાય છે. જે ઓરાક શરીરને તુકસાન પહોંચાડે છે, તે જ ઓરાક શરીરને માંદલું પણ અનાવે છે. માંદળી શરીરને યાત્યાત્સથાથી જ વૃદ્ધ અનાવે છે,

કારણું કે બાદયાવસ્થાર્થી જ માંહગીને લીધે શરીરને રહાસ થવાથી પ્રક્રિયાને પ્રારંભ થઈ જતો હોય છે.

ફ્રિપિત વાયુ, ફ્રિપિત પાણી, આગસ, ડસહીન ઓસાક, છીછરા શ્વાસ અને અકુદરતી ઓસાક—આ અધાં શરીરને વૃદ્ધ બનાવે છે ! આ અધી એવો છૂટચા પછી જ શારીરિક પ્રગતિ થઈ શકે છે. કારણેણાને ફૂર કરે, ઉપાય આપસેણે જ થઈ જશે.

રોગ વિનાના હેઠું એ શરીરની આંતરિક પ્રક્રિયા છે. શરીરના કોશોમાં રોગોને હૃતાવવાની શક્તિ છે.

‘વૃદ્ધાવસ્થા’ નામનો કોઈ રોગ જ નથી. વરસોની ગણુતરીએ ઉંમર પસાર થાય તેનાથી વૃદ્ધાવસ્થાના રોગની ઉત્પત્તિ થતી નથી. તમે શરીર સાથે જેટલો ખરાળ વ્યવહાર સાખ્યો અને જેમ જેમ દિવસો અને વરસો પસાર થતાં જશો, તેમ તેમ તમારી હશા પણ ખરાળ થતી જશે. જીવનનો આ એક સિદ્ધાંત છે—તમે જેવું વાવશો તેવું લણુશો. તમે જે વરતું મેળવવા માગતા હશો, તેની કીમત ચુકવવી જ પડશો. તમારાં પાપોની શિક્ષા તમારે ભોગવવી જ પડે છે—આ છે કાર્યું અને કારણુના સિદ્ધાંતની સમતુલ્યા.

જો તમે સો વરસ કે તેથી વધારે તંહુરસ્ત, સ્કૂર્ટિભય, ઉલ્વાસભય, ઉત્સાહપૂર્ણ અને યુવાનીભય જીવન પસાર કરવા ધ્યાચતા હો, તો તમારે સમતુલાના સિદ્ધાંતનું પાલન કરવું જ જોઈએ ! જીવનમાં તમે જે વાવો છો, તેની

જ તમે લણુણી કરો છો. આ સનાતન સત્ય છે. જીવનનું આ પ્રત્યક્ષ લક્ષ છે ! ધણુઅરા લોકો વાસ્તવિકતાને સામનો કરવા ઈચ્છા નથી. આ કારણને લીધે આ લોકોને રોગ અને દૂંકા આવરહાની કીમત ચૂકવવી પડે છે.

આજથી એક હુલર વરસ પછી પણ આ પુસ્તકમાં લખેલી હુકીકતો આજના જ જેટલી ઉપયોગી થઈ પડશે. આ વિષય પર લણાયેલાં પુસ્તકોનો હંમેશાં પ્રચાર થયા જ કરશે અને તે કચારેય જમાના ખાડારનાં (Out of Date) નહિ થાય.

આ હુનિયાના સામાન્ય નિયમો અનુસાર તમે તમારી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓને જાથેત કરશો, ત્યારે જ તમે ‘જીવતા રહેવા’ના સાચા વિજાનને જાણી શકશો. ઈચ્છારે આપણું સવાસો વરસ જીવવાનું વરહાન આપ્યું છે—આપણું નિયમોનું પાલન કરીએ અને આ વરહાન લોગવીએ.

આ એક કીમતી પુસ્તક છે ! આ પુસ્તકને તમારે હંમેશાં તમારી સાથે જ રાખવાનું છે અને તેનું વારંવાર અધ્યયન કરવાનું છે. આ પુસ્તકમાં લખેલા કુદરતી નિયમો તમારા જીવનનું એક અંગ ન બની જય ત્યાં સુધી તેનું મનન કરો ! આ નિયમોને તમારે યાદ રાખવાના છે. પછી તો તમે તમારી જાતે જ તમારી તંહુરસ્તી અને તમારા જીવનના ‘સરમુખત્યાર’ બની જશો. આપણા જીવનને આ નિયમો કાખૂમાં રાખી શકશો.

તંહુરસ્તીનું પ્રાગટય અંદરથી ખહાર થાય છે. તમે રોગ, માંદળી અને શારીરિક તકલીફીમાંથી છૂટી શકો છો તે હુકીકત છે. પરંતુ સોએ સો ટકા શક્તિમય અને સ્ક્રૂર્ટિંગ તંહુરસ્તીની પ્રાપ્તિ ટેવો કેળવીને જ મેળવી શકાય છે. આજના જમાનાએ આપણામાં ખરાણ ટેવોના જે સંસ્કાર ઠાંસી હીધા છે, તેમને સરળા કરવાનો કે તેમાં ફેરફાર કરવાનું શીખવવાનો જ આ પુરતકનો ઉદેશ છે.

તમારી તંહુરસ્તીનો આધાર તમારા પ્રત્યેક કલાક, પ્રત્યેક દ્વિવસ, પ્રત્યેક સ્પેટાહ, પ્રત્યેક માસ અને પ્રત્યેક વરસની ટેવો પર છે. તમે તમારી ટેવોના નક્કર પિંડડૃપ છો. આ એક સનાતન સત્ય છે કે તમારા શરીરને તેની ખરાણ ટેવોને લીધે કેટલીય વાર શિક્ષા સહન કરવી પડી છે. તમે ધૂમ્રપાન કર્યા શકો છો, શરાણ પી શકો છો, કસહુન જોરાક ખાઈ શકો છો, સારા હેખાઈ શકો છો અને સારા સંચોગણનો પણ અનુભવ કરી શકો છો. પરંતુ થોડીક ક્ષણો માટે તમારે મા કુદરતનું ઝણું અદા કરવું જ પડશો. એટલા માટે આરોગ્યપ્રદ ટેવો અપનાવો.

જ્યારે કંઈક ગરણડ પેહા થાય છે, હૃદયમાં તકલીફ થાય છે કે જીવન અને તંહુરસ્તીનો હાસ કરનારું એક પણ તત્ત્વ અસ્તિત્વ ધરાવે છે, ત્યારે તેને અનિયમિતતાનું પ્રતીક લેખવામાં આવે છે. પરોક્ષ રીતે તનો અર્થ થાય છે કે આપણે આપણા જીવનનાં વરસો મૃત્યુતુદ્વય પસાર કરીએ છીએ કે પછી મૃત્યુના આગોતરા આલાસવાળાં પસાર કરીએ છીએ.

મારી પાસે તમને રોગમુક્ત કરવાની કે રોગોની સારવાર કરવાની કોઈ હૈવી શક્તિ નથી. સાંપ્રત વિજાને તંહુરસ્તીપૂર્ણ આનંદમય જીવન પસાર કરવાની પદ્ધતિ ખતાવી છે. હું તમારી સમક્ષ એક શિક્ષક તરીકે જિલ્લો છું અને આજના વિજાને જીવન માટે કઈ કઈ સિદ્ધિએ મેળવી છે તેનું મિતાક્ષરી શાખદચ્ચિન રજૂ કરું છું. આપણી પાસે પ્રયોગના નિયમો છે. દીર્ଘયુધ્ય માટે કુદરતે જે નિયમોનું ઘડતર કર્યું છે, તે નિયમો પણ આપણી સામે જ છે. આ નિયમોનું પાલન કરીને દીર્ଘયુધ્ય પ્રાપ્ત કરવાનો આધાર તમારા જરૂર જ છે. તમે નિયમોનું પાલન કેટલી વિવેકભુદ્ધિથી કરો છો, તે પણ મહત્વનું છે. જ્યારે કોઈ વસ્તુ અસહ્ય થઈ પડે છે, ત્યારે તેની વૈજ્ઞાનિકતા દર્શનાઈ જાય છે. તમારી પાસે તંહુરસ્ત રહેવાના જ્ઞાનનો ભંડાર છે. આ ભંડારમાંથી તમે જ ખર્ચ કરી શકો છો !

મારી તો કેવળ એટલી જ ઈચ્છા છે કે તમે સાચ્ચા જ્ઞાનનો (સદ્ગુરૂ)પ્રયોગ કરીને યૌવન, ચાયલ્ય અને સ્કૂર્ટીં પ્રાપ્ત કરો અને બધા જ પ્રકારની તકલીફોમાંથી છુટકારો મેળવીને સુખી જીવન ગાળો.



વૃદ્ધ શા માટે બનો છો ?

ને લોકો જીવનનો ખાડુ ગંભીર અર્થ કરે છે; જેઓ પ્રત્યેક વસ્તુ તેમના પોતાના વ્યક્તિગત પ્રયત્નનો ઉપર આધાર રાખતી માને છે અને નિર્વાહનાં સાધનો મેળવવા માટે ચાલુ વૈતરામાં જેમના જીવન જય છે, તેમનો દેખાવ સખત હોઈ, તેમના વિચારો તેમના મોઢ પર દેખાય છે. આવા માણુસો જીવદી સુકાઈ જાય છે, તેમને શીଘ્ર કરયાદીઓ પ્રાપ્ત થાય છે; તેમના સનાયુઓ તેમના વિચાર જેવા સખત બની જાય છે અને તેમનું સ્વચ્છાંદી મગજ પણ શરીરને અકાળે વૃદ્ધ બનાવે છે; કારણું કે તેમની વિચારક્રિયા સખત, અમયુક્ત અને અકુદ્ધરતી હોય છે.

જે લોકો આનંદી અને સૌન્દર્યપ્રેમી હોય છે અને જેઓ શાંતિનો વિકાસ કરે છે, તેઓ ઉદ્ધાર અને ચિંતાઅસ્ત લોકોના જે ટલા જલદીથી વૃદ્ધ બનતા નથી.

આટલા બધા લોકો અકાળે વૃદ્ધ બને છે તેનું ખીજું એક કારણ એ છે કે, તેઓ વિકાસ પામતા બંધ થાય છે. આ એક શોયનીય ઘટના બને છે કે, ધણા માણુસો મધ્યમ વરે પહોંચ્યા પછી નવીન વિચારે અહુણું કરવા કે સ્વીકારવાને અશક્ત જણુય છે. ધણા માણુસો ચાલીસ કે પચાસ વર્ષની વરે પહોંચતાં જ નવીન વિચારે કરતા બંધ થાય છે!

## —એલિસન સ્વેટ માર્ડેન

## સહા ચુવાન રહેણો!

કહી પણ એમ ધારશો નહિ કે તમારી વય અધિક થઈ હોય એટલા માટે તમારે વિકાસ પામતા-પ્રગતિ કરતા બંધ થવું જોઈએ. જે તમે આવો વિચાર કરતા રહેશો તો તમે શીંગ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરશો. તમે તરુણ જ છો એ વિચારને કહી પણ તિલાંજલિ આપશો નહિ. કહી પણ એમ કહેશો નહિ કે અસુકતસુક ડાર્ય તમે એક સમયે કરી શકતા હતા, તેવી રીતે હાલ કરી શકતા નથી. તારુણ્યમય જીવન ગાળો. તમે ગમે એટલું આયુધ્ય લોગંયું હોય, તોપણ પુનઃ મન દ્વારા એક છોકરા કે છોકરીના જેવું જીવન ગાળતાં ઉરશો નહિ. તમારી રીતભાત એવી રાખજો કે એમાં વૃદ્ધાવસ્થાનું લેશ પણ ચિહ્ન આવે નહિ. સમરણમાં રાખજો કે સડી ગયેલું મન, ખવાઈ ગયેલું મગજ જ શરીરને વૃદ્ધ અનાવી હે છે. માટે વિકાસ પામતા રહેણ. તમારી આસપાસની પ્રત્યેક શુલ વસ્તુમાં રસ લેતા રહેણ.

—ઓરિસન સ્વેટ માર્ડન